



વાર્ષિક સામાન્ય સભાની નોટીસ

આથી ધી નવાનગર કો-ઓપરેટીવ બેંક લી., જામનગરના તમામ સભાસદોને જાણ કરવામાં આવે છે કે, આ બેંકની ૩૭મી વાર્ષિક સામાન્ય સભા તા.૨૭/૦૬/૨૦૧૫ ને શનિવારના રોજ સાંજે ૧૬:૩૦ કલાકે શ્રી કુંવરબાઈ જૈન ધર્મશાળા, ન્યુ જેલ રોડ, જામનગરમાં નીચે દર્શાવેલ કામગીરી માટે મળશે. આથી સર્વ સભાસદોને સમયસર હાજરી આપવા વિનંતી.

કાર્યસૂચિ (એજન્ડા)

- ૦૧. તા. ૨૮/૦૬/૨૦૧૪ના રોજ યોજાયેલ વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહી બહાલ રાખવા બાબત.
- ૦૨. તા. ૩૧/૦૩/૨૦૧૫ ના રોજ પુરા થયેલ વર્ષના ઓડીટ થયેલા હિસાબો તથા ઓડીટર્સ રીપોર્ટ મંજૂર કરવા તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરફથી ૨૦૧૪-૧૫ ના વર્ષનો રજૂ થયેલ કામકાજનો અહેવાલ મંજૂર કરવા.
- ૦૩. ૨૦૧૪-૧૫ ના વર્ષના ચોખ્ખા નફાની રકમ રૂ. ૫,૬૭,૯૬,૭૨૧.૫૮ પૈ. ની ફાળવણી મંજૂર કરવા.
- ૦૪. ૨૦૧૪-૧૫ ના વર્ષની સભાસદ ભેટ આપવા વિચારણા કરવા બાબત.
- ૦૫. નબળા ધિરાણ ખાતાઓની પતાવટથી થયેલ વસુલાતને બહાલી આપવા બાબત.
- ૦૬. ચેરમેનશ્રી તરફથી અગર તેમની મંજૂરીથી બેંકના હિતમાં રજૂ થાય તે પર વિચારણા કરી યોગ્ય કરવા.

જામનગર.
તા.૧૨/૦૬/૨૦૧૫

કિરણભાઈ માધવાણી
મેનેજિંગ ડાયરેક્ટર

- નોંધ: ૦૧. નફા નુકશાન ખાતુ તથા સરવૈયાની નકલ સભાસદને જોઈતી હોય તો બેંકની કોઈપણ શાખા પરથી મેળવી શકાશે.
૦૨. સભાસદોની યાદી તેમજ ક્રમાંક વગેરે જો જોવાના હોય તો બેંકની હિરજી મિસ્ત્રી રોડ પર પ્રણામી સ્કુલ સામે આવેલ બેંકની રજીસ્ટર્ડ ઓફીસ ખાતે જોઈ શકાશે.
૦૩. ગત વાર્ષિક સામાન્ય સભાની કાર્યવાહી આ સાથે સામેલ છે.
૦૪. સભા મળવાના સમયથી અડધા કલાક સુધીમાં કોરમ નહિ થાય તો સભા અડધો કલાક મુલતવી રાખવામાં આવશે અને સાંજના ૧૭:૦૦ કલાકે તે જ સ્થળે ફરીથી મળશે જેમાં કોરમનો બાધ રહેશે નહિં.
૦૫. જો સભાસદશ્રીઓને વાર્ષિક સામાન્ય સભામાં કોઈ પ્રશ્ન પુછવાના હોય તો બેંકને એક અઠવાડીયા પહેલા લેખિત જણાવવું જેથી વહીવટી ખુલાસા કરવામાં સરળતા રહે.

રજીસ્ટર્ડ ઓફીસ

નવાનગર બેંક ભવન, હિરજી મિસ્ત્રી રોડ, પ્રણામી સ્કુલ સામે, જામનગર - ૩૬૧ ૦૦૪. ફોન : ૨૫૬૩૯૮૮૪ - ૮૫
email : mail@nawanagarbank.co.in - ho@nawanagarbank.co.in

શ્રી અમ્બીન આર. ઝવેરી
ડેપ્યુટી જનરલ મેનેજર

શ્રી રામકૃષ્ણ ડી. અટીયા
આસી. જનરલ મેનેજર

દિગ્વિજય પ્લોટ શાખા :	શાખા મેનેજર : શ્રી અજય આર. શેઠ	૧૭-બી, દિગ્વિજય પ્લોટ, જામનગર-૩૬૧૦૦૫ ફોન : ૨૫૫૨૮૫૭, ૨૬૭૬૯૦૯ - ૨૬૭૧૩૪૮ - ૨૫૪૦૪૯૩ - ૨૫૪૦૧૬૭
ઉદ્યોગનગર શાખા :	શાખા મેનેજર : શ્રી રાજેશ એસ. શાહ	નવાનગર બેંક ભવન, હિરજી મિસ્ત્રી રોડ, પ્રણામી સ્કુલ સામે, શંકરટેકરી, ઉદ્યોગનગર, જામનગર - ૩૬૧ ૦૦૪ ફોન : ૨૫૬૩૯૩૯ - ૨૫૬૩૯૪૦ - ૨૫૬૮૫૮૫
હોસ્પિટલ રોડ શાખા :	શાખા મેનેજર : શ્રી પારસ એચ.કુંડલીયા	૧૦૧-૧૦૨-૧૦૩, 'ક્રોસ-વે', ઈન્દિરા માર્ગ કોર્નર, હોસ્પિટલ રોડ, જામનગર-૩૬૧ ૦૦૮. ફોન : ૨૬૭૧૫૪૩, ૨૬૭૧૫૧૯ - ૨૫૧૦૮૬૨
શરૂસેકશન શાખા :	શાખા મેનેજર : શ્રી પ્રદીપ એસ. શાહ	'તૃપ્તિ', પારસ સોસાયટી, પંચવટી શરૂ સેકશન રોડ, - જામનગર - ૩૬૧ ૦૦૮. ફોન : ૨૬૬૨૫૧૮, ૨૬૬૨૪૩૫ - ૨૫૧૦૮૬૧
રણજીતરોડ શાખા :	શાખા મેનેજર : શ્રી નિતિન એચ. મ્હેતા	સીમંધર કોમ્પ્લેક્સ, રણજીત રોડ, રતનબાઈ મસ્જીદની સામે, જામનગર - ૩૬૧ ૦૦૧. ફોન : ૨૫૪૧૨૩૬, ૨૫૪૧૨૩૩ - ૨૫૧૦૮૬૩
ગુલાબનગર શાખા :	શાખા મેનેજર : શ્રી રૂપેન પી. શાહ	ગુલાબનગર, રાજકોટ હાઈવે, જામનગર - ૩૬૧ ૦૦૭ ફોન : ૨૫૭૧૯૨૧ - ૨૫૭૧૫૬૮
દરેડ શાખા :	શાખા મેનેજર : શ્રી રાહુલ વી. માંકડ	જી.આઈ.ડી.સી., ફેસ-૨, દરેડ, જામનગર - ૩૬૧ ૦૦૫ ફોન : ૨૭૩૦૫૪૧ - ૨૭૩૦૫૪૨
ખંભાળીયા રોડ શાખા :	શાખા મેનેજર : શ્રી હરીશ સી. શાહ	મયુર કોમ્પ્લેક્સ, શોપ નં. ૭-૮, ખોડીયાર કોલોની, જામનગર - ૩૬૧ ૦૦૬. ફોન : ૨૭૧૨૧૩૪ - ૨૭૧૨૧૩૬
રણજીતસાગર રોડ શાખા :	શાખા મેનેજર : શ્રી ભરત એમ. છાપીયા	પ્લોટ નં ૩૩, ૩૪, ૩૫ હેવમોર એજન્સી પાસે, રણજીતસાગર રોડ જામનગર - ૩૬૧ ૦૦૬. ફોન : ૨૫૫૧૬૧૫ - ૨૫૫૧૬૬૧૬
હરિઆ એકસટેન્શન કાઉન્ટર	ઈન્ચાર્જ ઓફીસર : શ્રી દિલીપ કે. ખેતીયા	હરિઆ સ્કૂલ કમ્પાઉન્ડ, ઈન્દિરા માર્ગ, જામનગર - ૩૬૧ ૦૦૪. ફોન : ૨૫૬૪૪૩૮



સહકારી મિત્રો,

ધી નવાનગર કો-ઓપ. બેંક લી. ની આજની ૩૭મી સાઘારણ સભામાં આપ સૌને આવકારતા મને આનંદ થાય છે.

છેલ્લાં થોડાં વર્ષો દરમ્યાન સહકારી બેંકોએ અનેક પ્રકારની કટોકટીનો સામનો કર્યો છે. સહકારી બેંકો ઉપર રીઝર્વ બેંક, સરકારશ્રી વિગેરેના અનેક નિયંત્રણો પ્રવર્તે છે. આજના હરિફાઈના યુગમાં અસ્તિત્વ માટેની દોડ ચાલી રહી છે, એવા સંજોગો વચ્ચે પણ થાપણદારો તથા સભાસદોએ વહીવટકર્તાઓમાં સંપૂર્ણ વિશ્વાસ રાખ્યો છે, જેથી બેંકની થાપણોમાં ગયા વર્ષે રૂ. ૬૧.૫૯ કરોડ તેમજ ઘિરાણોમાં રૂ. ૩.૭૨ કરોડનો વધારો થયો છે. ચાલુ સાલ મંદીના માહોલ વચ્ચે પણ આપણી બેંકે અનેક પડકારોનો સામનો કરીને રૂ. ૧૨.૧૯ કરોડનો નફો કરેલ છે, આમ બેંકના નફામાં રૂ. ૮૯ લાખ જેટલો વધારો થયેલ છે. જેમાંથી જરૂરી જોગવાઈઓ કર્યા પછી ચોખ્ખો નફો રૂ. ૫.૬૮ કરોડનો થયેલ છે.

કાર્યકારી નફો	રૂ. ૧૨,૧૯,૫૦,૩૪૬.૫૮
અન્ય જોગવાઈઓ ખાતે લઈ જવાયેલ રકમ	રૂ. ૬,૫૧,૫૩,૬૨૫.૦૦
ચોખ્ખો નફો	રૂ. ૫,૬૭,૯૬,૭૨૧.૫૮

નફાની ફાળવણી : વર્ષ ૨૦૧૪-૨૦૧૫

	રકમ રૂ.	રકમ રૂ.
ચોખ્ખો નફો		૫,૬૭,૯૬,૭૨૧.૫૮
બાદ :		
રીઝર્વ ફંડ (ચોખ્ખા નફાના ૨૫%)	૧,૪૧,૯૯,૧૮૦.૫૮	
સહકારી શિક્ષણ ફંડ ખાતે (મહત્તમ (નફાના ૨.૫% અથવા મહત્તમ મર્યાદા મુજબ બેમાંથી જે ઓછું હોય તે)	૩,૦૦,૦૦૦.૦૦	
૧૫% ખરાબ લેણાંઅનામત (BAD DEBT RESERVES)	૮૫,૧૯,૫૦૯.૦૦	
શેર પર ડિવીડન્ડ (શેર મુડીના ૧૫%)	૧,૩૧,૭૪,૦૦૦.૦૦	
ઘમ્મદા ફંડ (ચોખ્ખા નફાના ૧%)	૫,૬૭,૯૬૭.૦૦	
શાખ સમકારી ફંડ ખાતે	૦.૦૦	૩,૬૭,૬૦,૬૫૬.૫૮
GAE :		
૨૫% બિલ્ડીંગ ફંડ ખાતે	૫૦,૦૯,૦૧૬.૦૦	
૧૦% ડિવિડન્ડ ઈકવીલાઈઝેશન ફંડ ખાતે	૨૦,૦૩,૬૦૬.૦૦	
૧૫% સહકારી પ્રચાર ફંડ ખાતે	૩૦,૦૫,૪૧૦.૦૦	
૯% સ્ટાફવેલ્ફેર ફંડ ખાતે	૧૮,૦૩,૨૪૬.૦૦	
૩૦% સભાસદ કલ્યાણ ફંડ ખાતે	૬૦,૧૦,૮૨૦.૦૦	
૩% કન્ટીજન્સી ફંડ ખાતે	૬,૦૧,૦૮૨.૦૦	
૨% શહેરી વિકાસ ફંડ ખાતે	૪,૦૦,૭૨૧.૦૦	
૬% સ્પેશ્યલ રીઝર્વ ફંડ ખાતે	૧૨,૦૨,૧૬૪.૦૦	૨,૦૦,૩૬,૦૬૫.૦૦

ઉપર જણાવેલ નફાની ફાળવણી પરથી આપ જાણી શકશો કે બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ શેર ઉપર ૧૫% લેખે ડિવીડન્ડ આપવાની ભલામણ કરે છે. જે સહકારી કાયદા મુજબ વધુ માં વધુ છે. સહકારી બેંકીંગ ક્ષેત્રે પ્રવર્તતા પ્રતિકુળ સંજોગો હોવા છતાં બેંકના કાર્યકારી નફામાં વધારો નોંધાયેલ છે.



બેંકના ડાયરેક્ટરશ્રીઓ, વરિષ્ઠ અધિકારીશ્રીઓ તથા સંનિષ્ઠ કર્મચારીઓ અને માનવંતા ગ્રાહકોના સહયારા આયોજન અને પ્રયત્નોથી આપણે વર્ષ દરમ્યાન થાપણો, ધિરાણો વગેરે તમામ ક્ષેત્રે નોંધપાત્ર સિધ્ધિઓ હાંસલ કરી શક્યા છીએ.

વર્ષ દરમ્યાન ૨૦૦૭ થી બેંકમાં ડાયરેક્ટર તરીકે જોડાયેલ શ્રી વૃજલાલ ખારેયા નું તા. ૧૧/૯/૧૪ નાં રોજ દુઃખદ અવસાન થયેલ છે. તેઓ તરફથી બેંકને ખુબ ઉપયોગી સહયોગ કામગીરીમાં મળેલ છે. તેની નોંધ લઈ છું ત્યાં બેંકને તેની પુરી ન શકાય તેવી ખોટ પડેલ છે.

બેંકના ધિરાણ લેનાર સભાસદોને પણ વધારે લાભ મળે તે હેતુથી ધિરાણના વ્યાજનાં દરો પણ અન્ય બેંકોની તુલનાએ ઘણા નીચા રાખેલા છે.

વાર્ષિક હિસાબો:

બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ વતી તા. ૩૧/૩/૨૦૧૫ ના રોજ પુરા થયેલ વર્ષનો અહેવાલ તથા ઓડીટ થયેલા વાર્ષિક હિસાબો આપની સમક્ષ આપ સૌની બહાલી માટે રજૂ કરું છું. મને જણાવતા આનંદ થાય છે કે આપણી બેંકે શરૂઆતથી અત્યાર સુધી ઓડીટ વર્ગ "અ" જાળવી રાખેલ છે.

થાપણો:

ઉપર જણાવેલ અતિ વિપરિત સંજોગો વચ્ચે પણ ૨૦૧૪-૧૫ ના નાણાંકીય વર્ષ દરમ્યાન બેંકની થાપણોમાં રૂ. ૬૧૬૦ લાખનો વધારો થતાં વર્ષાન્તે કુલ થાપણો રૂ. ૪૩૮૫૮.૨૭ લાખ થયેલ છે, જે દ્વારા અત્યાર સુધીના ઈતિહાસમાં એક નવું શિખર સર કરેલ છે. જે માટેનો યશ બેંક પર વિશ્વાસ મુકનાર આપણા થાપણદારો, સભાસદો, ગ્રાહકો અને કર્મચારીઓને આપવો ઘટે. બેંક આવી જ પ્રગતિ જાળવી રાખશે તેવી અપેક્ષા રાખવી અસ્થાને નથી.

રોકાણો:

બેંકનું ધિરાણ પ્રમાણમાં ઓછું હોય, બેંકનાં ફાજલ નાણાંનું રીઝર્વ બેંકના દિશા-નિર્દેશાનુસાર ની નીતિને અનુસરીને જ દરરોજ આવા નાણાંનું મહત્તમ વળતર મળે તેવી રીતે રોકાણો કરી નોંધપાત્ર આવક મેળવી છે.

ધિરાણો:

આપણી બેંકના સભાસદો માટે ખુબજ સરળ ધિરાણ પ્રક્રિયા, ધિરાણ પરના ખુબજ વ્યાજબી વ્યાજ દર, વગેરે પરિબળો થકી આ વર્ષે આપણા ધિરાણોમાં પણ વૃદ્ધિ થઈ છે

અને બેંકનું ધિરાણ રૂ. ૧૮,૨૦૫.૬૭ લાખથી વધી અત્યારે રૂ. ૧૮,૫૭૭.૮૯ લાખે પહોંચેલું છે, જે ધિરાણમાં રૂ. ૩.૭૨ કરોડનો વધારો દર્શાવે છે.

મુડી પર્યાપ્તતા:

રીઝર્વ બેંક દ્વારા મિલકતો સામેના સંભવિત જોખમોને પહોંચી વળવા માટેની પર્યાપ્તતા મૂડીનું ધોરણ (Capital to Risk of Assets Ratio - CRAR) લાગુ પાડવામાં આવેલ છે. જેના અનુસંધાને રીઝર્વ બેંકની સૂચના અનુસાર આપણી બેંક માટે તા. ૩૧/૦૩/૨૦૧૫ નાં રોજ આ ધોરણ ન્યુનત્તમ ૯% હોવું જોઈએ તેના બદલે આ ધોરણ હાલમાં ૨૮.૦૧% છે.

વસુલાત:

અગાઉના વર્ષોમાં સર્વવ્યાપી અભૂતપૂર્વ મંદીના કારણે સ્થાનિક ધંધા રોજગારમાં તીવ્ર મંદીનું મોજું ફરી વળ્યું હતું જે આપ સૌ કોઈ જાણો છો. આ સંજોગોમાં અમુક નબળા પડેલ ખાતાંઓમાં વસુલાત માટે સભાસદો સામે ના છુટકે કડક પગલાં લેવાની સંચાલક મંડળને ફરજ પડેલ. જરૂરી જોગવાઈઓ તેમજ વસુલાતના સતત પ્રયત્નોથી બેંકનું નેટ એન.પી.એ. 'ઝીરો' છે. સમગ્ર રાજ્યમાં આવી ઝીરો એન.પી.એ. વાળી જે જુજ સહકારી બેંકો છે, તેમાં આપણી બેંક પણ સામેલ છે. બાકીદાર સભાસદોને ખાસ વિનંતી કે તેઓ પોતાની ફરજ સમજી બેંકની લહેણી રકમ તથા વ્યાજ સમયસર ભરપાઈ કરી આપણી બેંકની નામના જાળવી રાખે. બેંકની નીતિ સામાન્ય રીતે સમજાવટ અને સહકારથી વસુલાત કરવાની છે જે માટે શક્ય હોય ત્યાં સુધી કરજદારની પરિસ્થિતિનો ક્યાસ કાઢી તેના પ્રશ્નોનું નિરાકરણ કાયદાઓની મર્યાદામાં રહીને થઈ શકતું હોય તો કરવાનાં પ્રયત્નો પણ કરવામાં આવે છે. જે કિસ્સાઓમાં કરજદાર કે તેમના જામીનો તરફથી હકારાત્મક પ્રત્યુત્તર કે સહકાર મળતો નથી તેમની સામે વિવિધ કાનૂનો નીચે વસુલાતની કડક કાર્યવાહી કરવાની ના છુટકે ફરજ પડે છે.

ડીવીડન્ડ:

આ વર્ષે પણ સભાસદોને ગુજરાત સરકારશ્રીના કાયદા અનુસાર મહત્તમ ૧૫% લેખે ડીવીડન્ડ આપવાનું સૂચવેલ છે.

સિધ્ધિઓ:

(૧) ભારતીય રિઝર્વ બેંક તરફથી બેંકને ગોકુલનગર માં શાખા ખોલવા માટે મંજૂરી મળેલ છે. જે ટુંક સમયમાં ખોલવામાં આવનાર છે.



(૨) બેંક તરફથી તમામ ખાતેદારોને RTGS/NEFT ની સુવિધા વિના મુલ્યે આપવામાં આવે છે.

(૩) જામનગરમાં આપણી એકમાત્ર સહકારી બેંક છે જે આધાર બેઈઝ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડાયેલ છે. જેથી આપણા ખાતેદારોને એલપીજી સબસીડી સીધી ખાતામાં જમા થાય છે.

(૪) ચાલુ વર્ષમાં બચત ખાતામાં આપણે મીનીમમ/એવરેજ બેલેન્સ ચાર્જ લેવાનું બંધ કરેલ છે.

(૫) કસ્ટમરોની સુવિધા માટે આઈડીબીઆઈ બેંક સાથે ટાઈઅપ કરી એટીએમ ની સુવિધા પુરી પાડવાનું નક્કી કરેલ છે.

(૬) — બેંકના ગ્રાહકો પોતાના વીજ વપરાશના બીલ આપણી બેંકમાં જ ભરી શકે તે માટે પી.જી.વી.સી.એલ. પાસેથી વીજ બીલ કલેક્શન સેન્ટરની મંજૂરી મેળવી શરૂ કરેલ છે.

સભાસદો:

સંચાલક મંડળ સભાસદોને પણ શક્ય તેટલી મદદ કરવા હંમેશા તત્પર રહે છે. બેંક તરફથી નીચેની વિગતે સભાસદોને મદદ કરવામાં આવે છે.

(૧) તબીબી સહાય :

સભાસદોને તેની બિમારી સબબ સભાસદ કલ્યાણ ફંડમાંથી મહત્તમ રૂા. ૧૨૫૦૦/- (અંકે રૂપિયા બાર હજાર પાંચસો પુરા) ની મર્યાદામાં થયેલ તબીબી ખર્ચના ૮૦% ની મર્યાદામાં સહાય આપવામાં આવે છે. આવી સહાય સને ૨૦૧૪-૧૫ ના વર્ષમાં ૩૮૫ સભાસદોને રૂા. ૩૮,૧૮,૮૦૨/- ચુકવેલ છે.

(૨) સભાસદોના બાળકોને શૈક્ષણિક પ્રોત્સાહન સહાય :

સભાસદોના તેજસ્વી બાળકોને શૈક્ષણિક પ્રોત્સાહન મળે તે માટે ઈનામી યોજના અમલમાં મુકેલ છે. આ ઈનામી યોજના નીચે સને ૨૦૧૪-૧૫ ના વર્ષમાં સભાસદના ૧૦૮૫ બાળકોને ઈનામ આપવામાં આવેલ હતું.

(૩) અવસાન પામેલ સભાસદના વારસદારોને મરણોત્તર સહાય :

બેંકના સભાસદનું અવસાન થાય ત્યારે તેના વારસદારને રૂા. ૧૦૦૦૦/- (અંકે રૂપિયા દશ હજાર પુરા) ની મરણોત્તર સહાય આપવામાં આવે છે. સને ૨૦૧૪-૧૫ ના વર્ષમાં આપણી બેંકના નીચે મુજબના અવસાન પામેલ

૩૮ સભાસદોને બેંક તરફથી મરણોત્તર સહાય ચુકવવામાં આવેલ છે. તેમજ અવસાન પામેલ સભાસદોના આત્માને મોક્ષગતી ની પ્રાપ્તિ થાય એવી બેંકના બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, સ્ટાફ તથા સભાસદો વતી હું પ્રાર્થના કરું છું.

(૧) અરવિંદ મનસુખલાલ છત્રાલા

(૨) ઈદુમતી દિનેશચંદ્ર લખિયર

(૩) શાંતિલાલ મગનલાલ મંગી

(૪) પુષ્પકાંત ત્રિભોવનદાસ શાહ

(૫) સવિતાબેન કાનજીભાઈ કણઝારીયા

(૬) અબ્બાસભાઈ ઈસ્માઈલજી ચીકાની

(૭) કાનજી પ્રાગજી ગજજર

(૮) અનિતાબેન ચેલારામ મેઘાણી

(૯) ગુલ્તાનસિંહ પોપટસિંહ ગોહેલ

(૧૦) શાંતિલાલ લખમશી સાવલા

(૧૧) દમયંતિ જયસુખલાલ ગણાત્રા

(૧૨) દિનેશચંદ્ર નાનજીભાઈ કનખરા

(૧૩) જયેશ હિંમતલાલ દોશી

(૧૪) ચંદ્રવદન હંસરાજ માલદે

(૧૫) રમણીકલાલ ગોરઘનદાસ ચાંદ્રા

(૧૬) અશ્વિન અમૃતલાલ ભટ્ટ

(૧૭) છોટાલાલ નરશીદાસ પારેખ

(૧૮) લક્ષ્મીબેન પુનમચંદ શાહ

(૧૯) ધીરેન્દ્ર નરોતમદાસ બુધ્ધભટ્ટિ

(૨૦) પ્રમોદ રસિકલાલ શાહ

(૨૧) હેમતકુમાર મગનલાલ લોઢિયા

(૨૨) ભિખાભાઈ ગોરઘનભાઈ પટેલ

(૨૩) અરવિંદ ઈશ્વરલાલ પારેખ

(૨૪) ભરત કિશોરચંદ્ર સુતરિયા

(૨૫) પ્રમોદકુમાર ગીરઘરલાલ વ્યાસ

(૨૬) પ્રીતમદાસ શામનદાસ ખેતાણી

(૨૭) ધાર્મીબેન પ્રહલાદરાય નંદાણી

(૨૮) તુલસીભાઈ જીવરાજ પટેલ



- (૨૯) કેશવલાલ ગોકલદાસ ઈસ્લાહીયા
- (૩૦) મુકેશ ગીરધરલાલ પુંજાણી
- (૩૧) મહેન્દ્રકુમાર રંગીલદાસ સુતરિયા
- (૩૨) કિશોર જગજીવન કટેશીયા
- (૩૩) પ્રવિણચંદ્ર કાલિદાસ કારીયા
- (૩૪) ગીરીશ ચિમનલાલ મહેતા
- (૩૫) તાહેરઅલી દાઉદભાઈ કોઈયા
- (૩૬) જયંતીલાલ જીવણલાલ કનખરા
- (૩૭) મહેશ છોટાલાલ વોરા
- (૩૮) અમીતાબેન રોહિતભાઈ શેઠ
- (૩૯) જયાબેન જુઠાલાલ શાહ

(૪) બેંક પોતાની સામાજિક જવાબદારી અદા કરવા માટે આરબીઆઈ ધ્વારા નક્કી કરેલ ચોખ્ખા નફાની ૧% મર્યાદામાં જામનગર જિલ્લા સહકારી સંઘ જામનગરની મંજૂરી મેળવી રૂ. ૪,૧૪,૫૦૦.૦૦ આર્થિક સહાય પુરી પાડેલ છે.

આભાર દર્શન :

બેંકની પ્રગતિ અને સફળ વહીવટ સંચાલનમાં નોંધપાત્ર ફાળો આપવા બદલ વાઈસ ચેરમેનશ્રી ધીરજલાલ જે. કનખરા, મેનેજિંગ ડાયરેક્ટરશ્રી કિરણભાઈ માઘવાણી તથા જોઈન્ટ મેનેજિંગ ડાયરેક્ટરશ્રી નિલેશભાઈ એમ. ટોલીયા તથા બોર્ડ ઓફ ડાયરેક્ટર્સના તમામ સભ્યશ્રીઓ કે જેઓએ બેંકના તમામ વિકાસ કાર્યોમાં ઉંડો રસ દાખવી

બેંકના વહીવટ અને નીતિ વિષયક નિર્ણયો માટે તેમના સલાહ સુચનો દ્વારા યોગદાન આપી અને અમુલ્ય સહકાર આપેલ છે તેબદલ સૌનો અંતઃકરણપૂર્વક આભાર માનું છું.

માનનિય જિલ્લા રજીસ્ટ્રારશ્રી તથા સ્ટેટયુટરી ઓડિટરશ્રી જયદીપભાઈ મહેતાનો આભાર વ્યક્ત કરું છું.

બેંકના પ્રારંભથી જ આજ દિવસ સુધી સેવાભાવી કાર્યકરો, વ્યાપાર ઉદ્યોગના અગ્રણીઓ તેમજ વિવિધ ક્ષેત્રોનાં વ્યવસાયલક્ષી અગ્રણીઓની સેવાઓ પ્રશંસનીય રહી છે. બેંકના વિકાસ માટે બોર્ડના સભ્યોએ પોતાનો કિંમતી સમય ફાળવી કોઈપણ જાતની સીટીંગ ફી અગર ભથ્થા લીધા વગર ડાયરેક્ટર તરીકે બેંકના વિકાસમાં અમુલ્ય ફાળો આપેલ છે.

બેંકના ઇન્ચાર્જ જનરલ મેનેજર શ્રી એ. આર. ઝવેરી, આસી. જનરલ મેનેજર શ્રી આર. ડી. અઢીયા, શાખા મેનેજરો, અધિકારીઓ તથા કર્મચારીગણે બેંકની રોજબરોજની કામગીરી આ બેંકને પોતાની સંસ્થા ગણી ખંત, ઉત્સાહ અને વફાદારી સાથે જવાબદારીપૂર્વક અદા કરી ગ્રાહકોનો અતૂટ વિશ્વાસ સંપાદન કરેલ છે. આગામી વર્ષોમાં પણ ઉત્તરોત્તર પ્રગતિ સાધવા તેઓ કટીબદ્ધ બની રહે તેવો અનુરોધ કરું છું.

આ સાથે આપણી બેંકની પાંચ વર્ષની પ્રગતિની રૂપરેખા પણ નીચે કોષ્ટકમાં આપેલ છે.

આપણી બેંકનું ભવિષ્ય વધુ ને વધુ ઉજ્જવળ બને તથા બેંકની ઉત્તરોત્તર પ્રગતિ થાય તેવી શુભ કામનાઓ સાથે આપ સૌના સાથ અને સહકારની અપેક્ષા સાથે બેંક પ્રગતિનાં ઉન્નત શિખરો સર કરે તેવી પરમ કૃપાળુ જગત નિયંતાને અભ્યર્થના સાથે વિરમું છું.

આપનો વિશ્વાસુ
રમણિકલાલ કે. શાહ

પાંચ વર્ષની બેંકની પ્રગતિની રૂપરેખા (રકમ રૂપીયામાં)

વિગત	૨૦૧૦-૨૦૧૧	૨૦૧૧-૨૦૧૨	૨૦૧૨-૨૦૧૩	૨૦૧૩-૨૦૧૪	૨૦૧૪-૨૦૧૫
ભરપાઈ શેર મુદી	૫,૬૮,૪૮,૦૦૦	૬,૬૨,૩૭,૦૦૦	૭,૩૮,૮૩,૦૦૦	૮,૪૨,૪૯,૧૦૦	૯,૨૩,૯૭,૦૦૦
રીઝર્વ્સ	૭૮,૮૨,૫૩,૦૦૦	૮૫,૪૯,૬૪,૦૦૦	૯૧,૩૭,૪૨,૦૦૦	૯૮,૨૫,૬૯,૦૦૦	૧,૦૨,૮૬,૯૯,૦૦૦
થાપણો	૨,૭૭,૧૨,૯૩,૦૦૦	૩,૦૨,૯૭,૪૮,૦૦૦	૩,૩૯,૮૬,૧૬,૦૦૦	૩,૭૬,૯૮,૭૩,૦૦૦	૪,૩૮,૫૮,૨૭,૦૦૦
ધિરાણો	૧,૧૫,૦૯,૫૫,૦૦૦	૧,૪૨,૬૧,૪૦,૦૦૦	૧,૬૦,૮૨,૬૪,૦૦૦	૧,૮૨,૦૫,૬૮,૦૦૦	૧,૮૫,૭૭,૮૯,૦૦૦
ચોખ્ખો નફો	૪,૬૫,૫૭,૦૦૦	૪,૮૬,૧૩,૦૦૦	૫,૧૨,૪૧,૦૦૦	૫,૦૬,૬૦,૦૦૦	૫,૬૭,૯૭,૦૦૦
કાર્યકારી ભંડોળ	૩,૭૩,૯૧,૩૯,૦૦૦	૪,૦૩,૧૧,૫૫,૦૦૦	૪,૪૬,૩૬,૧૭,૦૦૦	૪,૯૩,૫૦,૯૪,૦૦૦	૫,૬૨,૮૩,૯૫,૦૦૦
ઓડીટ વર્ગ	અ	અ	અ	અ	અ



Jaydeep Mehta & Associates

Chartered Accountant

Auditor's Report

To,
All Members,
The Nawanager Cooperative Bank Ltd., Jamnagar. _____

1. Report on the Financial Statement

We have audited the accompanying financial statements of **THE NAWANAGAR CO-OPERATIVE BANK LTD.**, which comprises the Balance Sheet as at 31st March, 2015 and also the Profit and Loss Account and the Cash Flow Statement for the year then ended and a summary of significant accounting policies and other explanatory information.

2. Management's Responsibility for the Financial Statements

The management of the bank is responsible for the preparation of these financial statement that give true and fair view of the financial position, financial performance and cash flows of the bank in accordance with the Accounting Standards issued by the Institute of Chartered Accountants of India and the Banking Regulation Act, complying with Reserve Bank of India guidelines from time to time. This responsibility include the design, implementation and maintenance of the internal control relevant to the preparation and fair presentation of the financial statement that give a true and fair view and are free from material misstatement, whether due to fraud and error.

3. Auditor's Responsibility

Our responsibility is to express an opinion on these financial statements based on our audit. We conducted our audit in accordance with the Standards on Auditing issued by the Institute of Chartered Accountants of India. Those Standards require that we comply with ethical requirements and plan and perform the audit to obtain reasonable assurance about whether the financial statements are free from material misstatement.

An audit involves performing procedures to obtain audit evidence about the amounts and disclosures in the financial statements. The procedures selected depend on the auditor's judgment, including the assessment of the risks of material misstatement of the financial statements, whether due to fraud or error. In making those risk assessments, the auditor considers internal control relevant to the Bank's preparation and fair presentation of the financial statements in order to design audit procedures that are appropriate in the circumstances, but not for the purposes of expressing an opinion on the effectiveness of the Bank's Internal Control. An audit also includes evaluating the appropriateness of accounting policies used and the reasonableness of the accounting estimates made by management, as well as evaluating the overall presentation of the financial statements.

We believe that the audit evidence we have obtained is sufficient and appropriate to provide a basis for our audit opinion.

4. Opinion

In our opinion and to the best of our information and according to the explanations given to us, the financial statements subject to :

- (i) our comments and observation contained in audit memorandum (Samanya Shero & Khas Shero) annexed with Part-I & II furnished as per the Gujarat Co-Operative Societies Act, 1961;
- (ii) Notes on accounts forming part of the financial statements;



give the information required by the Banking Regulation Act, 1949 as well as the Gujarat Co-operative Societies Act, 1961 and rules made there under, in the manner so required, for the urban co-operative bank and give a true and fair view in conformity with the accounting principles generally accepted in India.

- (a) in the case of the Balance Sheet, of the state of affairs of the Bank as at 31st March, 2015;
- (b) in the case of the Profit & Loss Account, of the Profit for the year ended on that date; and
- (c) in the case of the Cash Flow Statement, of the cash flows for the year ended on that date.

5. Report on Other Legal and Regulatory Requirements

We report that:

1. We have obtained all the information and explanation which to the best of our knowledge and belief were necessary for the purpose of our audit;
2. In our opinion, proper books of accounts as required by law have been kept by the Bank so far as appears from our examination of those books.
3. The Balance Sheet, the Profit and Loss Account and the Cash Flow Statement dealt with by this report are in agreement with the Books of accounts and returns.
4. In our opinion and according to information given to us, the transactions of the Bank, which have come to our notice, have been within the competence of the Bank.
5. The Board of Directors has conducted the working of the bank as per bye-laws and also provisions of cooperative law/rules. The Board of Directors has followed the rules and regulations.
6. The Board of Directors has carried out the instructions of RBI, given from time to time.
7. Bank has maintained SLR and CRR standards according to rules prevail from time to time of RBI.
8. Bank has made classification of NPAs as per RBI guidelines and sufficient provisions are made for the same.
9. The advances allowed to members of the board of director or their relatives are as per RBI Guidelines and in term of provisions of cooperative law. All such advances are recoverable.
10. The directors or other office bearers are not disqualified for the position.
11. The guidelines for the one time settlement of advances and Set-off of deposits against advances are adhered to by the bank.
12. In cases of write-off/compromise of the dues undertaken during the year instructions given by the RBI and Registrar of Cooperative Societies are adhered to by the bank.
13. In case of compromise of dues through courts, bank's interest is not jeopardised.
14. Aforesaid audit work is as per our criteria for the audit period ended on 31st March 2015.

Jaydeep Mehta & Associates

Chartered Accountants (FRN : 122154W)

CA. Jaydeep Mehta

Proprietor (Mem. No. 102782)

Penal No. 1029

Place: Jamnagar

Date: 1st June, 2015



તા. ૩૧/૦૩/૨૦૧૫ ના રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું

ખર્ચ	૩૧-૦૩-૨૦૧૪		૩૧-૦૩-૨૦૧૫	
	રૂ.	પૈસા	રૂ.	પૈસા
શ્રી ચુકવેલ વ્યાજ થાપણ અને કરજ પર	૨૨,૬૬,૩૮,૮૪૮.૦૦		૨૭,૬૧,૭૨,૫૪૦.૭૮	
શ્રી પગાર એલાઉન્સીઝ અને પ્રોવિડન્ટ ફંડ	૪,૭૫,૯૩,૭૫૮.૦૦		૫,૦૧,૯૪,૧૧૩.૦૦	
શ્રી ડાયરેક્ટર્સ ફી		૦.૦૦		૦.૦૦
શ્રી સ્ટેશનરી તથા પ્રિન્ટીંગ	૧૩,૩૫,૬૯૭.૯૯		૧૧,૪૦,૬૦૦.૮૮	
શ્રી જાહેરાત ખર્ચ	૬,૨૨,૨૩૮.૦૦		૭,૨૪,૫૭૩.૦૦	
શ્રી પોસ્ટેજ, ટેલીગ્રામ અને ટેલીફોન ખર્ચ	૫,૫૩,૫૬૦.૦૪		૫,૮૦,૦૨૦.૨૧	
શ્રી વિમા પ્રિમીયમ	૪૨,૧૯,૫૦૫.૦૦		૪૪,૭૦,૫૩૯.૦૦	
શ્રી ઓડીટ ફી	૫,૦૪,૦૦૦.૦૦		૭,૪૬,૦૨૦.૦૦	
શ્રી ઈલેક્ટ્રીક ખર્ચ	૨૧,૦૩,૨૮૦.૦૦		૨૩,૨૭,૦૯૬.૦૦	
શ્રી લવાજમ	૧,૧૩,૧૯૨.૦૦		૧,૨૩,૨૧૨.૦૦	
શ્રી પરચુરણ ખર્ચ	૧૬,૪૨,૧૨૪.૬૦		૧૭,૩૩,૧૨૩.૬૫	
શ્રી લીગલ એડવાઈઝર્સ/કન્સલ્ટન્ટ્સ ફી	૪,૯૦,૦૫૨.૦૦		૨,૦૧,૬૦૮.૦૦	
શ્રી મકાન ભાડું અને વેરો	૩૧,૬૩,૬૪૭.૦૦		૩૧,૨૯,૭૮૨.૦૦	
શ્રી મકાન મરામત ખર્ચ	૭,૬૨,૪૫૯.૦૦		૩,૧૪,૪૫૧.૦૦	
શ્રી મુસાફરી ખર્ચ	૯૭,૨૯૬.૦૦		૧,૨૧,૦૪૫.૭૯	
શ્રી ઘસારા ખર્ચ - ફર્નિચર તથા મકાન ઉપર	૭૦,૮૩,૮૪૬.૪૪		૭૭,૪૨,૦૯૩.૦૦	
શ્રી સ્ટાફ ગ્રુપ ગ્રેચ્યુઈટી પ્રીમીયમ	૨,૫૨,૭૩૮.૦૦		૧૪,૫૦,૪૬૪.૦૦	
શ્રી કોમ્પ્યુટર ખર્ચ	૧૮,૫૬,૯૧૦.૦૦		૧૯,૯૮,૪૨૯.૮૦	
શ્રી જંગમ મિલકતો વેચતા થયેલ નુકશાન	૮૨,૪૯૩.૦૦		૧૮,૨૪૪.૯૨	
શ્રી જામીનગીરી ખરીદી પ્રીમીયમ	૪,૬૬,૪૮૦.૦૦		૨,૫૯,૪૨૦.૦૦	
શ્રી સર્વિસ ટેક્સ	૨૦,૩૪,૨૮૩.૭૦		૧૯,૯૮,૬૯૬.૫૩	
શ્રી લીગલ ખર્ચ	૪૧,૯૧૦.૦૦		૯૫,૮૬૨.૦૦	
શ્રી કન્વેન્સ ખર્ચ	૪,૪૯,૭૭૫.૦૦		૪,૫૩,૪૯૬.૦૦	
સરવાળો પાછળના પાને લઈ ગયા	૩૦,૨૧,૦૮,૦૯૩.૭૭		૩૫,૫૯,૯૫,૪૩૧.૫૬	



તા. ૩૧/૦૩/૨૦૧૫ ના રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું

આવક	૩૧-૦૩-૨૦૧૪		૩૧-૦૩-૨૦૧૫	
	રૂ.	પૈસા	રૂ.	પૈસા
શ્રી વ્યાજ આવક ધિરાણ અને રોકાણ ઉપર	૪૦,૨૯,૫૬,૪૦૯.૯૩		૪૬,૩૦,૯૮,૫૦૮.૭૦	
શ્રી કમિશન	૧૬,૪૮,૦૩૨.૮૭		૧૨,૫૭,૫૧૫.૨૦	
શ્રી લોકર ભાડા ખાતે	૨૬,૨૮,૪૧૬.૭૦		૩૨,૭૦,૯૦૦.૦૦	
શ્રી ગતવર્ષમાં માંડવાળ કરેલ ધિરાણ ખાતામાં આવેલ વસુલાત	૨,૨૫,૧૭૧.૭૮		૦.૦૦	
પરચુરણ આવક	૮,૨૯,૪૭૮.૯૩		૪,૮૦,૩૫૫.૪૯	
ઈન્સીડેન્ટલ ચાર્જ	૨૬,૫૦,૬૧૪.૮૬		૨૨,૦૩,૩૨૦.૫૮	
શેર ટ્રાન્સફર ફી	૩૨,૭૩૬.૦૦		૨૭,૪૫૭.૦૦	
ઈનસ્પેક્શન ચાર્જ	૧૭,૩૯,૦૧૦.૪૮		૧૭,૪૯,૯૯૪.૬૩	
ડીવીડન્ડ ઈન્કમ	૭૫૦.૦૦		૭૫૦.૦૦	
લીમીટ પ્રોસે. ચાર્જ	૫૬,૫૭,૨૪૧.૦૦		૫૧,૮૧,૮૫૬.૦૦	
એન્ટ્રીફી	૬૪૫.૦૦		૦.૦૦	
જંગમ મિલકત વેચતા થયેલ નફો	૧,૪૨,૬૫૦.૦૦		૧,૦૯,૫૯૩.૦૦	
નોમીનલ મેમ્બર ફી	૨૩,૦૨૫.૦૦		૩,૪૦૦.૦૦	
રેફરલ ફી આવક	૧૪,૦૫,૮૬૪.૬૨		૧૬,૦૫,૩૧૯.૨૬	
સ્પે. એડહેસીવ સ્ટેમ્પસ વેચતા મળેલ કમીશન	૫,૯૦,૦૦૦.૦૦		૮,૦૦,૦૦૦.૦૦	
ચેકબુક ઈસ્યુ ચાર્જસ	૯,૩૨,૪૫૫.૦૦		૮,૭૪,૨૮૯.૦૦	
ચૂંટણીફોર્મ ફી આવક	૨૪.૦૦		૦.૦૦	
ફલડ આઈ.ટી. આવક	૫૨,૭૦૦.૦૦		૦.૦૦	
ઈન્કમેટેક્સ રીફંડ ૨૦૦૯-૧૦	૦.૦૦		૪,૧૮,૨૩૦.૦૦	
સરવાળો પાછળના પાને લઈ ગયા	૪૨,૧૫,૧૫,૨૨૬.૧૭		૪૮,૧૦,૮૧,૪૮૮.૮૬	



તા. ૩૧/૦૩/૨૦૧૫ ના રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું

ખર્ચ	૩૧-૦૩-૨૦૧૪		૩૧-૦૩-૨૦૧૫	
	રૂ.	પૈસા	રૂ.	પૈસા
કુલ સરવાળો આગળ લાવ્યા....	૩૦,૨૧,૦૮,૦૯૩.૭૭		૩૫,૫૯,૯૫,૪૩૧.૫૬	
ઇલેક્ટ્રીક ફિટીંગ ખર્ચ	૨૧,૪૬૩.૦૦		૩૫,૨૮૧.૦૦	
મીટીંગ ખર્ચ	૯૩,૪૯૩.૦૦		૯૬,૮૩૫.૦૦	
સીક્યોરીટી સર્વિસ ચાર્જ	૬,૦૪,૦૮૫.૫૦		૬,૯૩,૧૯૭	
કલીયરીંગ હાઉસ ચાર્જસ	૬,૧૨,૬૭૭.૦		૦.૦૦	
ઇન્કમ ટેક્સ અપીલ ફી	૦.૦૦		૧,૦૦૦.૦૦	
ડીમેટ / એસજીએલ. ટ્રાન્ઝે ખર્ચ	૨,૫૨૮.૨૦		૨,૭૫૨.૦૨	
એન્યુઅલ જનરલ મીટીંગ ખર્ચ	૧,૭૮,૫૭૯.૦૦		૪૯,૮૫૧.૦૦	
ઇકવીપમેન્ટ મેઇન્ટેનન્સ ખર્ચ	૩,૨૨,૨૮૨.૫૦		૬,૬૪,૮૫૪.૫૯	
એડવાઇઝરી ફી ગીલ્ટ / સીબીલ	૦.૦૦		૧,૮૮,૩૩૪.૦૦	
બેંક ચાર્જસ	૧૨,૩૦૯.૧૮		૮૪,૭૪૫.૧૧	
પ્રોફેશનલ ટેક્સ	૧૪,૦૦૦.૦૦		૧૪,૦૦૦.૦૦	
કેશ પીક-અપ વાન ચાર્જસ	૨,૫૫,૮૯૪.૦૦		૨,૬૫,૪૮૩.૦૦	
બુક્સ એન્ડ પીરીયોડીકલ્સ	૭,૦૪૦.૦૦		૬,૬૦૨.૦૦	
હાઉસકીર્પીંગ ખર્ચ	૩,૦૩,૬૭૫.૦૦		૨,૮૦,૩૧૭.૦૦	
અગાઉના વર્ષમાં ચુકવેલ ઇન્કમટેક્સ	૩૮,૬૯,૧૭૦.૦૦		૭,૫૨,૪૫૯.૦૦	
કોમ્પ્યુટર એ.એમ.સી. ખર્ચ	૪૬,૨૦૬.૦૦		૦.૦૦	
ઇન્ટરેસ્ટ પેઈડ ઓન સીક્યોરીટી	૯૧,૦૦૦.૦૦		૦.૦૦	
જોગવાઈ				
પ્રોવિઝન ફોર બેડ એન્ડ ડાઉટફુટ ડેબ્ટ્સ એકાઉન્ટ	૪૮,૦૦,૦૦૦.૦૦		૮૫,૦૦,૦૦૦.૦૦	
પ્રોવિઝન ફોર ઇન્કમટેક્સ	૧,૮૫,૦૦,૦૦૦.૦૦		૩,૫૫,૦૦,૦૦૦.૦૦	
શ્રી સ્ટાફ બોનસની જોગવાઈ	૧૨,૬૮૯.૦૯		૧૩,૬૨૫.૦૦	
શ્રી પ્રોડક્ટીવીટી લીન્કડ ઇન્સેન્ટીવ	૬૬,૦૦,૦૦૦.૦૦		૭૪,૦૦,૦૦૦.૦૦	
શ્રી સ્ટાન્ડર્ડ એસેટ્સ સામે આકસ્મિક જોગવાઈ	૪૫,૦૦,૦૦૦.૦૦		૪૫,૦૦,૦૦૦.૦૦	
શ્રી નિયમીત કરજદારોને ચુકવવાપાત્ર વળતર જોગવાઈ	૨૯,૦૦,૦૦૦.૦૦		૪૦,૦૦,૦૦૦.૦૦	
શ્રી સભાસદ ભેટની જોગવાઈ	૫૦,૦૦,૦૦૦.૦૦		૫૧,૦૦,૦૦૦.૦૦	
શ્રી ઇન્વેસ્ટમેન્ટ ડેપ્રીશીયેશન રીઝર્વ	૨,૦૦,૦૦,૦૦૦.૦૦		૦.૦૦	
શ્રી ડિફર્ડ ટેક્સ પ્રોવિઝન	૦.૦૦		૧,૪૦,૦૦૦	
શ્રી ચાલુ વર્ષનો ચોખ્ખો નફો	૫,૦૬,૬૦,૦૪૦.૯૩		૫,૬૭,૯૬,૭૨૧.૫૮	
કુલ સરવાળો....	૪૨,૧૫,૧૫,૨૨૬.૧૭		૪૮,૧૦,૮૧,૪૮૮.૮૬	



તા. ૩૧/૦૩/૨૦૧૫ ના રોજ પુરા થતાં વર્ષનું નફા-નુકશાન ખાતું

આવક	૩૧-૦૩-૨૦૧૪		૩૧-૦૩-૨૦૧૫	
	રૂ.	પૈસા	રૂ.	પૈસા
કુલ સરવાળો આગળ લાવ્યા....	૪૨,૧૫,૧૫,૨૨૬.૧૭		૪૮,૧૦,૮૧,૪૮૮.૮૬	
કુલ સરવાળો....	૪૨,૧૫,૧૫,૨૨૬.૧૭		૪૮,૧૦,૮૧,૪૮૮.૮૬	

અમારા આજ તારીખના સાથેના ઓડિટ રીપોર્ટ તેમજ હિસાબ અંગેની વિશેષ નોંધને આધીન.

સ્થળ : જામનગર.

તારીખ : ૦૧-૦૬-૨૦૧૫

જયદીપ મહેતા એન્ડ એસોસીયેટ

ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ

સહી/-જયદીપ ડી. મહેતા

મેમ્બરશીપ નં. ૧૦૨૭૮૨, પેનલ નં. ૧૦૨૯

શ્રી રમણીકલાલ કે. શાહ
ચેરમેન

શ્રી ધીરજલાલ જે. કનખરા
વાઈસ ચેરમેન

શ્રી કિરણભાઈ આર. માધવાણી
મેનેજિંગ ડાયરેક્ટર

શ્રી નિલેશભાઈ એમ. ટોલીયા
જો. મેનેજિંગ ડાયરેક્ટર

ડાયરેક્ટર્સ

શ્રી ધીરજલાલ એમ. શાહ
શ્રી પરમાણંદભાઈ વી. ખટ્ટર
શ્રી સતિષચંદ્ર એમ. કુંડલીયા
શ્રી ચંદુલાલ આર. શાહ

શ્રી નાથાલાલ વી. મુંગરા
શ્રી સુભાષચંદ્ર કે. શાહ
શ્રી હિતેષભાઈ જી. પરમાર
શ્રી હસમુખભાઈ ઈ. હિન્ડોયા

શ્રી વિજયકુમાર એમ. શેઠ
શ્રી પ્રશાંતભાઈ એમ. મહર્ષિ

શ્રી અમ્વીન આર. ઝવેરી
ડે. જનરલ મેનેજર

શ્રી રામકૃષ્ણ ડી. અદિયા
આસી. જનરલ મેનેજર



તા. ૩૧/૦૩/૨૦૧૫ ના રોજનું સરવૈયું

૩૧/૦૩/૨૦૧૪ રૂા. પૈસા	મૂડી અને જવાબદારીઓ	રૂા. પૈસા	૩૧/૦૩/૨૦૧૫ રૂા. પૈસા
<u>૧૦,૦૦,૦૦,૦૦૦.૦૦</u>	(૧) શેર ભંડોળ ૧. અધિકૃત શેર ભંડોળ દરેક રૂા. ૨૫/- ના એક એવા ૪૦,૦૦,૦૦૦ શેર્સ		<u>૧૦,૦૦,૦૦,૦૦૦.૦૦</u>
૮,૪૨,૪૯,૧૦૦.૦૦	૨. ભરપાઈ થયેલ શેર ભંડોળ દરેકના રૂા. ૨૫/- એવા ૩૬૯૫૮૯૯ શેર્સ પૈકી ૧) વ્યક્તિઓએ ધારણ કરેલ ૨) સહકારી મંડળીઓએ ધારણ કરેલ ૩) સરકારશ્રીએ ધારણ કરેલ	૯,૨૩,૯૭,૪૭૫.૦૦	૯,૨૩,૯૭,૪૭૫.૦૦
---	(૨) રીઝર્વ ફંડ અને અન્ય રીઝર્વ	---	---
૨૨,૧૩,૪૫,૬૭૯.૭૭	૦૧. રીઝર્વ ફંડ	૨૪,૭૪,૫૬,૫૨૧.૭૦	
૨૨,૪૯,૬૯૨.૪૫	૦૨. ધર્માદા કલ્યાણ ફંડ	૨૩,૪૧,૭૯૨.૪૫	
૧૦,૭૫,૨૪,૦૫૧.૦૦	૦૩. બીલ્ડીંગ ફંડ	૧૧,૧૦,૬૧,૮૪૧.૦૦	
૨,૫૫,૩૦,૯૬૧.૦૦	૦૪. ડીવીડન્ડ ઈકવીલાઈઝેશન ફંડ	૧,૩૮,૫૭,૪૮૪.૦૦	
૧૨,૩૩,૯૭,૯૪૭.૬૮	૦૫. બેંક એન્ડ ડાઉટફુલ ડેટ રીઝર્વ	૧૩,૦૯,૯૬,૯૫૩.૬૮	
૨,૬૦,૮૦,૮૬૫.૯૦	૦૬. સહકારી પ્રચાર ફંડ	૨,૭૭,૮૯,૫૧૩.૯૦	
૭૯,૪૧,૦૫૩.૦૦	૦૭. સીલ્વર જ્યુબેલી ફંડ	૭૯,૪૧,૦૫૩.૦૦	
૯૩,૦૮,૪૫૬.૪૦	૦૮. સભાસદ કલ્યાણ ફંડ	૯૧,૨૯,૦૦૭.૪૦	
૪,૪૧,૫૮,૨૯૬.૪૦	૦૯. કન્ટ્રીજન્સી ફંડ	૪,૪૫,૧૪,૨૬૪.૬૧	
૧૦,૭૯,૬૭,૨૨૩.૩૫	૧૦. ઈન્વેસ્ટમેન્ટ ફલકચ્યુએશન રીઝર્વ	૧૦,૭૯,૬૭,૨૨૩.૩૫	
૧,૦૨,૧૭,૮૭૧.૨૫	૧૧. સીટી ડેવલોપમેન્ટ ફંડ	૧,૦૪,૯૬,૬૯૪.૨૫	
૪,૦૪,૫૦,૦૦૦.૦૦	૧૨. સ્ટાન્ડર્ડ એસેટસ માટે આકસ્મિક જોગવાઈ	૪,૪૯,૫૦,૦૦૦.૦૦	
૪,૫૭,૨૫,૫૭૦.૦૦	૧૩. સ્પેશ્યલ રીઝર્વ ફંડ	૪,૬૫,૭૪,૬૪૦.૦૦	
૬,૯૧,૨૧,૨૦૮.૫૫	૧૪. ઈન્વેસ્ટમેન્ટ ડેપ્રીસીએશન રીઝર્વ	૬,૯૧,૨૧,૨૦૮.૫૫	
૫,૧૬,૫૦,૦૦૦.૦૦	૧૫. બેંક એન્ડ ડાઉટફુલ ડેટ પ્રોવીઝન	૬,૦૧,૫૦,૦૦૦.૦૦	
૨,૧૦,૮૮,૪૪૭.૦૦	૧૬. શાખ સમકારી ફંડ	૨,૪૯,૨૬,૭૧૨.૦૦	
૯૭,૮૭,૮૮૫.૦૦	૧૭. સભાસદ ભેટની જોગવાઈ	૧,૦૪,૦૯,૨૬૫.૦૦	
૯,૧૯૯.૨૧	૧૮. સ્ટાફ વેલફેર ફંડ	૦.૦૦	
<u>૫,૯૦,૧૪,૯૯૭.૦૦</u>	૧૯. ઈન્વેસ્ટમેન્ટ ડેપ્રી. રીઝર્વ (એમ.એમ.સી.બી.)	૫,૯૦,૧૪,૯૯૭.૦૦	
<u>૯૮,૨૫,૬૯,૪૦૪.૯૬</u>			<u>૧,૦૨,૮૬,૯૯,૧૭૧.૮૯</u>
<u>૧,૦૬,૬૮,૧૮,૫૦૪.૯૬</u>	સરવાળો પાછળના પાને લઈ ગયા		<u>૧,૧૨,૧૦,૯૬,૬૪૬.૮૯</u>



તા. ૩૧/૦૩/૨૦૧૫ ના રોજનું સરવૈયું

૩૧/૦૩/૨૦૧૪ રૂ. પૈસા	મિલ્કત અને લેણાં	રૂ. પૈસા	૩૧/૦૩/૨૦૧૫ રૂ. પૈસા
૨૯,૮૮,૭૬,૪૯૧.૪૨	(૧) રોકડ તથા બેંકોમાં હાથ ઉપર સિલક, રીઝર્વ બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા / સ્ટેટ / સેન્ટ્રલ કો.ઓ. બેંકમાં		૧૧,૪૯,૩૨,૯૭૯.૩૪
૧૦,૧૨,૯૭,૦૬૬.૪૮	(૨) બીજી બેંકોમાં બેલેન્સ		
૦.૦૦	૧. ચાલુ ખાતામાં	૨૧,૨૬,૨૭,૧૪૪.૨૯	
૫૬,૨૨,૭૧,૨૧૭.૦૦	૨. સેવિંગ્સ ખાતામાં	૦.૦૦	
૬૬,૩૫,૬૮,૨૮૩.૪૮	૩. ફીક્સડ ડીપોઝિટો	૫૦,૬૭,૫૮,૩૩૪.૦૦	૭૧,૯૩,૮૫,૪૭૮.૨૯
૦.૦૦	(૩) ટૂંકી મુદતની કોલ ડીપોઝિટ બેંકોમાં:		૦.૦૦
	(૪) રોકાણો :		
૧,૯૪,૭૯,૯૪,૪૬૫.૦૦	૧. સેન્ટ્રલ અને સ્ટેટ ગવર્નમેન્ટ સીક્યોરીટીઝ	૨,૭૧,૭૦,૫૪,૪૬૫.૦૦	
૦.૦૦	૨. બીજી ટ્રસ્ટી સીક્યોરીટીઝમાં	૦.૦૦	
૫,૦૫૦.૦૦	૩. સહકારી બેંકોના શેરોમાં	૫,૦૫૦.૦૦	
૨,૩૨,૯૦,૭૪૭.૫૦	૪. બીજા રોકાણો	૨,૩૨,૯૦,૭૪૭.૫૦	૨,૭૪,૦૩,૫૦,૨૬૨.૫૦
૧,૯૭,૧૨,૯૦,૨૬૨.૫૦	(૫) પ્રિન્સીપાલ/સબસીડીયરી સ્ટેટ પાર્ટનરશીપ ફંડમાંથી રોકાણો		૦.૦૦
૦.૦૦	(૬) દિરાણો		
૯૭,૭૨,૯૧,૧૧૯.૯૯	૧. ટૂંકી મુદતની લોન, કેશ કેડીટ, ઓવરડ્રાફ્ટ અને વટાવેલા બીલો જે પૈકી	૯૮,૦૫,૪૨,૫૯૦.૪૭	
---	(૧) સરકારી જામીનગીરી સામે	---	---
	(૨) બીજી વાસ્તવિક જામીનગીરી સામે	૯૮,૦૫,૪૨,૫૯૦.૪૭	
	જે પૈકી વ્યક્તિઓ પાસે લેણું	૯૮,૦૫,૪૨,૫૯૦.૪૭	
	ધિરાણ પૈકી મુદત વીતેલ બાકી	૩,૬૫,૦૨,૩૮૩.૦૩	
	ધિરાણ પૈકી ડુબત અને શકમંદ લેણું	૧,૭૦,૦૭,૯૩૨.૭૦	
૨,૯૩,૩૭,૩૫,૦૩૭.૪૦	સરવાળો પાછળના પાને લઈ ગયા		૩,૫૭,૪૬,૬૮,૭૨૦.૧૩



તા. ૩૧/૦૩/૨૦૧૫ ના રોજનું સરવૈયું

૩૧/૦૩/૨૦૧૪ રૂ. પૈસા	મૂડી અને જવાબદારીઓ	રૂ. પૈસા	૩૧/૦૩/૨૦૧૫ રૂ. પૈસા
૧,૦૬,૬૮,૧૮,૫૦૪.૯૬	પાછલો સરવાળો		૧,૧૨,૧૦,૯૬,૬૪૬.૮૯
	(૩) થાપણો અને અન્ય ખાતાઓ :		
૨,૨૧,૬૧,૪૬,૯૯૬.૭૫	:૧: ફિક્સ ડિપોઝીટ :	૨,૬૫,૪૫,૯૧,૦૧૫.૫૨	
	૧. વ્યક્તિઓ ૨,૫૭,૫૩,૭૩,૫૩૧.૫૨		
	૨. મધ્યસ્થ બેંકો ૦.૦૦		
	૩. અન્ય મંડળીઓ ૭,૯૨,૧૭,૪૮૪.૦૦		
૧,૧૪,૬૩,૩૮,૭૫૬.૦૫	:૨: સેવિંગ્સ ડિપોઝીટ :	૧,૨૮,૭૮,૨૪,૩૮૩.૩૦	
	૧. વ્યક્તિઓ ૧,૨૭,૭૩,૫૬,૩૮૪.૩૬		
	૨. મધ્યસ્થ બેંકો ૦.૦૦		
	૩. અન્ય મંડળીઓ ૧,૦૪,૬૭,૯૯૮.૬૪		
૪૦,૭૩,૮૭,૦૭૮.૮૮	:૩: કરન્ટ ડિપોઝીટ :	૪૪,૩૪,૧૧,૩૨૮.૨૦	
	૧. વ્યક્તિઓ ૪૩,૭૯,૨૩,૯૯૬.૬૫		
	૨. મધ્યસ્થ બેંકો ૦.૦૦		
	૩. અન્ય મંડળીઓ ૫૪,૮૭,૩૩૧.૫૫		
૩,૭૬,૯૮,૭૨,૮૩૧.૬૮	(૪) કરજ		૪,૩૮,૫૮,૨૬,૭૨૭.૦૨
૦.૦૦	:૧: રીઝર્વ બેંક, સ્ટેટ/સેન્ટ્રલ કો-ઓપ.બેંકોમાંથી		૦.૦૦
	:અ: ટુંકી મુદતની લોન, કેશ કેડીટ અને ઓવરડ્રાફ્ટ ચૈકી		
	૧) સરકારી જામીનગીરી સામે		
	૨) અન્ય વાસ્તવીક જામીનગીરી સામે		
	:બ: મધ્ય મુદતની લોન		
	:ક: લાંબી મુદતની લોન		
૦.૦૦	:૨: સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા અને અન્ય બેંકોમાંથી		૦.૦૦
	:અ: ટુંકી મુદતની લોન, કેશ કેડીટ અને ઓવરડ્રાફ્ટ ચૈકી		
	૧) સરકારી જામીનગીરી સામે		
૦.૦૦	૨) અન્ય વાસ્તવીક જામીનગીરી સામે		૦.૦૦
૪,૮૩,૬૬,૯૧,૩૩૬.૬૪	સરવાળો પાછળના પાને લઈ ગયા		૫,૫૦,૬૯,૨૩,૩૭૩.૯૧



તા. ૩૧/૦૩/૨૦૧૫ ના રોજનું સરવૈયું

૩૧/૦૩/૨૦૧૪		મિલકત અને લેણાં	૩૧/૦૩/૨૦૧૫	
રૂ.	પૈસા		રૂ.	પૈસા
૨,૯૩,૩૭,૩૫,૦૩૭.૪૦		પાછલો સરવાળો		૩,૫૭,૪૬,૬૮,૭૨૦.૧૩
૧૮,૯૭,૫૮,૪૪૫.૫૦		૨. મધ્યમ મુદતની લોન જે પેકી (૧) સરકારી જામીનગીરી સામે --- (૨) બીજી વાસ્તવીક જામીનગીરી સામે ૪૦,૮૪,૧૭,૩૭૯.૨૩ જે પેકી વ્યક્તિઓ પાસે લેણું ૪૦,૮૪,૧૭,૩૭૯.૨૩ ધિરાણ પેકી મુદત વીતેલ બાકી ૭૭,૪૪,૪૬૮.૮૧ ધિરાણ પેકી ડુબત અને શકમંદ લેણું ૩૮,૭૬,૬૭૨.૨૫	૪૦,૮૪,૧૭,૩૭૯.૨૩	
૬૪,૩૫,૧૮,૧૦૨.૩૨		૩. લાંબી મુદતની લોન જે પેકી (૧) સરકારી જામીનગીરી સામે --- (૨) બીજી વાસ્તવીક જામીનગીરી સામે ૪૬,૮૮,૨૮,૯૨૨.૯૯ જે પેકી વ્યક્તિઓ પાસે લેણું ૪૬,૮૮,૨૮,૯૨૨.૯૯ ધિરાણ પેકી મુદત વીતેલ બાકી ૭૧,૬૯,૬૫૦.૬૨ ધિરાણ પેકી ડુબત અને શકમંદ લેણું ૫૮,૧૯,૬૬૯.૦૦ કુલ ધિરાણ	૪૬,૮૮,૨૮,૯૨૨.૯૯	
૧,૮૨,૦૫,૬૭,૬૬૭.૮૧		(બ) મળવાપાત્ર વ્યાજ (રોકાણો ઉપર)		૧,૮૫,૭૭,૮૮,૮૯૨.૬૯
૫,૭૪,૩૫,૮૩૭.૦૦		(૮) બીલ્સ રીસીવેબલ સામે બાજુ બતાવ્યા મુજબ		૫,૯૫,૦૨,૭૬૮.૦૦
૩,૪૨,૧૭૬.૦૦		૧. (અ) ઈનવર્ડ બીલ્સ રીસીવેબલ	૨,૦૩,૫૭૧.૦૦	
૬,૨૪,૯૩૮.૦૦		(બ) આઉટવર્ડ બીલ્સ રીસીવેબલ	૪,૭૦,૧૭૬.૦૦	
૯,૬૭,૧૧૪.૦૦				૬,૭૩,૭૪૭.૦૦
૧,૬૩,૨૧,૦૮૯.૬૫		૨. ઈન્ટરેસ્ટ રીસીવેબલ (એન.પી.એ. ખાતાઓ)		૨,૧૨,૧૦,૦૭૪.૬૫
૧૦,૭૬,૯૯૧.૦૦		૩. અનકલેઈમ્ડ મેમ્બર ગીફ્ટ		૧૫,૦૬,૦૯૬.૦૦
		૪. અનકલેઈમ્ડ ડીપોઝીટ - આર.બી.આઈ.		૧,૧૧,૬૯,૪૯૩.૨૦
		(૯) જામીનગીરી કર કપાત તથા એડવાન્સ ટેકસ		
૩,૯૨,૨૨૩.૦૦		(૧) ટીડીએસ રીસીવેબલ	૪,૨૪,૭૮૭.૦૦	
૨,૮૭,૬૬,૨૧૯.૦૦		(૨) એડવાન્સ ઈન્કમ ટેકસ	૪,૦૨,૨૬,૪૫૬.૦૦	
૨,૯૧,૫૮,૪૪૨.૦૦				૪,૦૬,૫૧,૨૪૩.૦૦
૫,૬૧,૬૮,૪૪૫.૬૦		(૧૦) સ્થાવર મિલકત (ઘસારા બાદ)		૫,૪૬,૬૨,૨૩૭.૬૦
૩,૦૦,૦૮,૦૬૩.૭૯		(૧૧) ફર્નીચર / ફીકચર્સ (ઘસારા બાદ)		૨,૭૭,૨૫,૬૭૪.૬૨
૪,૯૪,૫૪,૩૮,૭૮૮.૨૫		સરવાળો પાછળના પાને લઈ ગયા		૫,૬૪,૯૫,૫૮,૯૪૬.૮૯



તા. ૩૧/૦૩/૨૦૧૫ ના રોજનું સરવૈયું

૩૧/૦૩/૨૦૧૪ રૂા. પૈસા	મૂડી અને જવાબદારીઓ	રૂા. પૈસા	૩૧/૦૩/૨૦૧૫ રૂા. પૈસા
૪,૮૩,૬૬,૯૧,૩૩૬.૬૪	પાછલો સરવાળો		૫,૫૦,૬૯,૨૩,૩૭૩.૯૧
૩,૪૨,૧૭૬.૦૦	(૫) બીલ્સ ફોર કલેક્શન સામી બાજુ બતાવ્યા પ્રમાણે		
૬,૨૪,૯૩૮.૦૦	:૧: (અ) ઈન્વર્ડ બીલ્સ કલેક્શન	૨,૦૩,૫૭૧.૦૦	
૯,૬૭,૧૧૪.૦૦	(બ) આઉટવર્ડ બીલ્સ કલેક્શન	૪,૭૦,૧૭૬.૦૦	૬,૭૩,૭૪૭.૦૦
૧,૬૩,૨૧,૦૮૯.૬૫	:૨: ઓવરડયુઈન્ટરેસ્ટ રીઝર્વ (એન.પી.એ.ખાતા)	૨,૧૨,૧૦,૦૭૪.૬૫	૨,૧૨,૧૦,૦૭૪.૬૫
૧૦,૭૬,૯૯૧.૦૦	:૩: અનકલેઈમ્ડ મેમ્બર ગીફ્ટ	૧૫,૦૬,૦૯૬.૦૦	૧૫,૦૬,૦૯૬.૦૦
---	:૪: અનકલેઈમ્ડ ડીપોઝિટ આર.બી.આઈ.	૧,૧૧,૬૯,૪૯૩.૨૦	૧,૧૧,૬૯,૪૯૩.૨૦
૬,૩૪,૯૩૧.૧૪	(૬) બાન્ય એડજેસ્ટમેન્ટ	---	૮,૪૨,૯૧૮.૧૪
	(૭) ઓવરડયુ ઈન્ટરેસ્ટ રીઝર્વ		૦.૦૦
	(૮) ચુકવવાપાત્ર વ્યાજ :		
	(૯) બીજી જવાબદારીઓ :		
૧૯,૩૨,૦૧૨.૦૦	૧. અન કલેઈમ્ડ રિવીડન્ડ	૨૮,૮૮,૨૦૫.૦૦	
૨,૧૨,૧૩,૧૬૧.૮૮	૨. ભરવાપાત્ર બીલો	૧,૮૫,૩૮,૮૪૬.૦૬	
૩૫,૯૨,૫૭૬.૭૧	૩. બેડ એન્ડ ડાઉટફુલ ડેબ્ટ રીટર્ન ઓફ	૩૫,૯૨,૫૭૬.૭૧	
૧,૯૦,૨૦,૦૦૦.૦૦	૪. ઈન્કમેટેક્સ સંબંધી જોગવાઈઓ	૩,૬૧,૬૦,૦૦૦.૦૦	
૨,૭૩,૫૯૫.૦૦	૫. અન્ય	૪,૭૩,૬૦૧.૧૫	
૪,૬૦,૩૧,૩૪૫.૫૯			૬,૧૬,૫૩,૨૨૮.૯૨
	(૧૦) નફા લુકશાન ખાતું		
	ગઈસાલનો નફો ૫,૦૬,૬૦,૦૪૦.૯૩		
	બાદ : ફાળવણી ૫,૦૬,૬૦,૦૪૦.૯૩		
૫,૦૬,૬૦,૦૪૦.૯૩	ઉમેરો ચાલુ સાલનો નફો ૫,૬૭,૯૬,૭૨૧.૫૮		૫,૬૭,૯૬,૭૨૧.૫૮
	(૧૧) કન્ટ્રીજન્ટ જવાબદારીઓ		
	આ આકસ્મિક જવાબદારીઓ સંબંધિત ખાતેદારોની		
	સ્થાવર/જંગમ મિલકતો દ્વારા સુરક્ષિત છે.		
	ગઈસાલ ૩૨,૯૫,૦૦૦.૦૦		
	ચાલુસાલ ૩૨,૯૫,૦૦૦.૦૦		
૪,૯૫,૨૩,૮૨,૮૪૮.૯૫	કુલ સરવાળો		૫,૬૬,૦૭,૭૫,૬૫૩.૪૦



તા. ૩૧/૦૩/૨૦૧૫ ના રોજનું સરવૈયું

૩૧/૦૩/૨૦૧૪ રૂ. પૈસા	મિલકત અને લેણાં	રૂ. પૈસા	૩૧/૦૩/૨૦૧૫ રૂ. પૈસા
૪,૯૪,૫૪,૩૮,૭૮૮.૨૫	પાછલો સરવાળો		૫,૬૪,૯૫,૫૮,૯૪૬.૮૯
	(૧૨) અન્ય અસ્કયામતો		
૫૩,૩૮૬.૦૦	૦૧. ટેલીફોન ડીપોઝીટ	૬૪,૩૮૬.૦૦	
૭,૦૦૦.૦૦	૦૨. એડવાન્સ પેમેન્ટ	૧૦,૦૦૦.૦૦	
૧,૬૦૦.૦૦	૦૩. ગેસ ડીપોઝીટ	૧,૬૦૦.૦૦	
૭,૫૩,૩૦૯.૮૮	૦૪. સ્ટેશનરી સ્ટોક	૮,૭૪,૩૮૫.૦૦	
૧,૦૮૩.૮૨	૦૫. કલીયરીંગ એડજેસ્ટમેન્ટ	૦.૦૦	
૩૬,૪૪,૫૦૨.૦૦	૦૬. એડહેસીવ સ્ટેમ્પસ ફોર સેલ	૪૦,૫૬,૫૭૦.૦૦	
૪,૮૧,૨૮૧.૦૦	૦૭. જી.ઈ.બી. મીટર ડીપોઝીટ	૪,૮૧,૬૪૨.૦૦	
૧,૦૦,૦૦૦.૦૦	૦૮. બ્રાંચ બિલ્ડિંગ મેઈન્ટેનન્સ ડીપોઝીટ	૧,૦૦,૦૦૦.૦૦	
૧,૦૩,૮૫૧.૦૦	૦૯. અગાઉથી ચુકવેલ ખર્ચા	૧,૫૫,૩૮૮.૦૦	
૨,૦૦,૦૦૦.૦૦	૧૦. લેન્ડ પ્રીમાઈસીસ	૨,૦૦,૦૦૦.૦૦	
૨,૧૫૦.૦૦	૧૧. વોટર કનેક્શન ડીપોઝીટ	૨,૧૫૦.૦૦	
૩,૧૨૩.૦૦	૧૨. એડહેસીવ સ્ટેમ્પસ	૪,૧૫૩.૦૦	
૦.૦૦	૧૩. કોમ્પ્યુટર એડવાન્સ	૭,૩૦,૬૯૧.૦૦	
૯,૪૮,૭૭૪.૦૦	૧૪. ગુલાબનગર શાખા બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન ખાતું	૨૯,૩૧,૩૨૪.૦૦	
૬૦૦.૦૦	૧૫. લોકર સ્ટેમ્પ	૬૦૦.૦૦	
૨,૬૬,૦૦૦.૦૦	૧૬. ફેસ્ટીવલ એડવાન્સ	૨,૫૫,૦૦૦.૦૦	
૦.૦૦	૧૭. સસ્પેન્શ લો ચાર્જીસ	૧,૨૩,૪૭૧.૦૦	
૦.૦૦	૧૮. પી.જી.વી.સી.એલ.બીલ કલેક્શન ડીપોઝીટ	૯,૦૦,૦૦૦.૦૦	
૦.૦૦	૧૯. મળવાપાત્ર અન-કલેઈમ્ડ ડીપોઝીટ આર.બી.આઈ.	૧,૯૭,૪૬૬.૫૧	
૬૫,૬૬,૭૬૦.૭૦			૧,૧૦,૯૮,૮૨૬.૫૧
૩,૭૭,૩૦૦.૦૦	(૧૩) રેસીડ્યુઅલ પ્રિમીયમ ઓન પરચેઈઝ ઓફ સીક્યોરીટીઝ		૧,૧૭,૮૮૦.૦૦
૪,૯૫,૨૩,૮૨,૮૪૮.૯૫	કુલ સરવાળો		૫,૬૬,૦૭,૭૫,૬૫૩.૪૦

અમારા આજ તારીખના સાથેના ઓડિટ રીપોર્ટ તેમજ હિસાબ અંગેની વિશેષ નોંધને આધીન.
સ્થળ : જામનગર.
તારીખ : ૦૧-૦૬-૨૦૧૫

જયદીપ મહેતા એન્ડ એસોસીયેટ
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ
સહી/-જયદીપ ડી. મહેતા
મેમ્બરશીપ નં. ૧૦૨૭૮૨, પેનલ નં. ૧૦૨૯

શ્રી રમણીકલાલ કે. શાહ
ચેરમેન

શ્રી ધીરજલાલ જે. કનખરા
વાઈસ ચેરમેન

શ્રી કિરણભાઈ આર. માધવાણી
મેનેજિંગ ડાયરેક્ટર

શ્રી નિલેશભાઈ એમ. ટોલીયા
જો. મેનેજિંગ ડાયરેક્ટર

ડાયરેક્ટર્સ

શ્રી ધીરજલાલ એમ. શાહ
શ્રી પરમાણંદભાઈ વી. ખટ્ટર
શ્રી સતિષચંદ્ર એમ. કુંડલીયા
શ્રી ચંદુલાલ આર. શાહ

શ્રી નાથાલાલ વી. મુંગરા
શ્રી સુભાષચંદ્ર કે. શાહ
શ્રી હિતેષભાઈ જી. પરમાર
શ્રી હસમુખભાઈ ઈ. હિન્ડોયા

શ્રી વિજયકુમાર એમ. શેઠ
શ્રી પ્રશાંતભાઈ એમ. મહર્ષિ

શ્રી અમ્વીન આર. ઝવેરી
ડે. જનરલ મેનેજર

શ્રી રામકૃષ્ણ ડી. અદિયા
આસી. જનરલ મેનેજર

**Notes forming part of the Balance Sheet as at 31st March, 2015 and Profit and Loss Account for the year ended 31st March, 2015****(A) Background :**

The Nawanagar Co-Operative Bank Ltd. was incorporated in 1980 and at present, having 9 Branches and 1 Extension Counter. The Bank provides various products which caters to the needs of its customers.

(B) Significant Accounting Policies :**1. Accounting Convention**

The accompanying Financial Statements have been prepared and presented under the historical cost convention on accrual basis of accounting, unless otherwise stated, on a going concern basis and comply with the generally accepted accounting principles, statutory requirements prescribed under the Banking Regulation Act, 1949, and the Gujarat Co-Operative Act, 1961, circulars and guidelines issued by the Reserve Bank of India ('RBI') from time to time, and the current practices prevailing amongst the Co-operative Banks in India.

2. Use of Estimates

The preparation of the financial statements, in conformity with generally accepted accounting principles, requires management to make estimates and assumptions that affect the reported amounts of assets and liabilities, revenues and expenses and disclosure of contingent liabilities at the date of the financial statements. Actual results could differ from those estimates. Management believes that the estimates used in the preparation of the financial statements are prudent and reasonable. Any revision to the accounting estimates are recognized prospectively.

3. Investments**3.1 Categorisation of Investments :**

In accordance with the guidelines issued by RBI, the Bank classifies its investment portfolio into three categories viz. 'Held to Maturity', "Available for Sale" and "Held for Trading".

In respect of Securities included in any of the above three categories where interest / principle is in arrears for more than 180 days, income is not recognized as per prudential norms.

3.2 Classification of Investments :

For the purpose of Disclosure in Balance Sheet investments have been classified as required under RBI Guidelines - Government Securities (Central & State), Other approved Securities, Shares of Other Co-operative Institutions and other Investments.

3.3 Valuation of Investments :

(i) **Held to Maturity:** Investments in HTM category are valued at acquisition cost unless it is more than the face value in which case the premium (if any) paid on the investments under this category is shown under "Other Assets" and is amortised over the period remaining to maturity.

(ii) **Held for Trading & Available for Sale :** Investments under AFS and HFT categories are valued scrip-wise at lower of Book Value and Market Value and depreciation/appreciation is aggregated for each classification. Net depreciation, if any, is provided for while net appreciation, if any, is ignored. Net Depreciation for the year under these categories is charged to the Profit and Loss Account.

(iii) Shares of Co-operative Institutions and Financial Corporations are valued at cost unless there is a diminution in the value thereof in which case the diminution is fully provided for.

(iv) Market Value of the Government Securities under available for sale is determined in terms of Yield to Maturity (YTM) method indicated by Fixed Income Money Market & Derivatives Association of India (FIMMDA).

(v) Broken period interest in respect of the Government Securities purchased is treated as an item of expenditure under the Profit and Loss account.

**4. Advances**

(I) All Advances are classified as Standard, Sub-standard, Doubtful and Loss Assets in accordance with guidelines issued by RBI. Provisions are made in accordance with the prudential norms prescribed by Reserve Bank of India.

(ii) The overdue interest in respect of non-performing advances is provided separately under Overdue Interest Reserve as per directives issued by RBI.

5. Fixed Assets and Depreciation

(i) Premises and other fixed Assets have been accounted for at historical cost less Depreciation.

(ii) Fixed Assets except computers are depreciated on Written Down Value Method at the rate considered appropriate by the management. Computers are depreciated on Straight Line Method @ 33.33% as directed by RBI.

(iii) Depreciation on Fixed Assets purchased during the year is charged for the entire year if asset is purchased and retained for 180 days or more. Otherwise it is charged at 50% of the normal rate. No depreciation is charged on assets sold during the year.

(iv) Fixed assets which have been fully depreciated but are still in use, are carried in the books at Rs. 1/-.

Accounting Standards 6 and 10 issued by the Institute of Chartered Accountants of India relating to Accounting for Fixed Assets and depreciation requires for disclosure of gross and net values of assets and accumulated depreciation thereon. However, as per the format applicable to the Co-operative Banks, the above disclosure are not made in the accounts and to that extent, the disclosure norms of the Accounting standards as referred above have not been followed. However, the same has no impact on the results of the bank.

6. Revenue Recognition**(I) Income**

Interest and other income are recognized on accrual basis except the following, which are recognized on realization basis as per RBI guidelines.

(a) Interest and other income on Non Performing Advances as per RBI Norms

(b) Locker Rent (c) Commission income (d) Commission on stamp vending

(e) Income from distribution of insurance products

(ii) Expenditure

Revenue expenditure is accounted for on accrual basis except the following, which are recognized on payment.

(a) Postage and Local Authorities Dues etc. (b) Service charges for Annual Maintenance contract.

(c) Electricity and Telephone bills.

7. Employee Benefits (AS – 15)

The Bank has taken group gratuity insurance with the Life Insurance Corporation of India for payment of retirement gratuity as well as leave encashment under the Scheme of this corporation. The annual contribution to Gratuity Fund and leave encashment are paid on yearly premium basis. The Bank has funded on retirement gratuity and leave encashment to Life Insurance Corporation of India amounting to Rs. 14,55,054/- (Previous year : Rs. 2,52,738/-) and Rs. 6,21,265/- (Previous year : Rs. 12,90,867/-) respectively.

The Bank's contribution to provident fund is accounted for on the basis of contribution to the Employees' Provident Fund Scheme Account set up by the Government on accrual basis.

8. Segment Reporting (AS – 17)

The bank is organized into two main business segments mainly :

(a) Treasury

**(b) Other Banking operations**

However, the above disclosure are not made in the accounts and to that extent, the disclosure norms of the Accounting standards as referred above have not been followed. However, the same has no impact on the results of the bank.

9. Operating Leases (AS – 19)

Lease rental obligations in respect of assets taken on operating lease are charged to Profit and Loss Account on straight line basis over the lease term. Initial direct costs are charged to profit and loss account. The bank has paid lease rental of Rs. 29,16,185/- (Previous Year : Rs. 29,29,290/-)

10. Income Tax (AS – 22)

Provision for Current Tax is made on the basis of estimated taxable income for the year.

Deferred tax is recognized, subject to consideration of prudence, on timing difference, representing the difference between taxable income and accounting income that originated in one period and is capable of reversal in one or more subsequent periods. Deferred tax assets and liabilities are measured using tax rates and tax laws that have been enacted or substantially enacted by the Balance Sheet date.

11. Impairment of Assets (AS – 28)

The bank has ascertained that there is no material impairment of any of its assets except unsecured portion of NPA advance, against which necessary provision is made in line with the RBI guidelines. Hence, in the opinion of bank no separate provision under accounting standard – 28 on impairment of Assets (AS – 28) issued by the ICAI is required.

12. Accounting for Provisions, Contingent Liabilities (AS – 29)

(a) The bank recognizes provisions only when it has a present obligation as a result of past events and the existence of which will be confirmed only by the occurrence or non-occurrence of one or more uncertain future events not wholly within the control of the Bank.

(b) Contingent Assets are not recognized since this may result in the recognition of income that will never be realized.

(C) OTHER NOTES FORMING PART OF ACCOUNTS FOR THE YEAR 2014-15**1. Share Capital**

Share Capital stated in the Balance Sheet as on 31st March, 2015 includes Linking Share Capital. The details of Corpus Share Capital and Linking Share Capital cannot be ascertained and hence not disclosed.

2. Provision for contingencies

Net profit is arrived at after “provision and contingencies” which includes.

- (a) Bad Debt Reserve
- (b) Investment Depreciation Reserve
- (c) Provision for income Tax
- (d) Staff bonus payable
- (e) Provision for Productivity Linked Incentive
- (f) Provision against Standard Assets
- (g) Investment Fluctuation Reserve
- (h) Provision for members Gift

**3. Investments include fixed deposits pledged as follows :**

(a) Rs. 6,57,16,060/- (Previous Year : Rs. 7,99,73,130/-) pledged with Bank of Baroda, Ranjit Road Branch, Jamnagar against overdraft limit sanctioned to the bank. The balance outstanding against the said facility as on 31.03.2015 was Rs. NIL. (Previous Year : Rs. NIL)

(b) Rs. 6,32,34,164/- (Previous Year : Rs. 6,22,58,895/-) pledged with Central Bank of India, SSI Area Branch, Jamnagar against overdraft limit sanctioned to the bank. The balance outstanding against the said facility as on 31.03.2015 was Rs. NIL. (Previous Year : Rs. NIL)

(c) Rs. 5,70,00,000/- (Previous Year : Rs. 10,00,00,000/-) pledged with IDBI Bank Ltd., Jamnagar against overdraft limit sanctioned to the bank. The balance outstanding against the said facility as on 31.03.2015 was Rs. NIL. (Previous Year : Rs. NIL)

(d) Rs. NIL /- (Previous Year : Rs. 2,00,00,000/-) pledged with Jamnagar District Co. Operative Bank Ltd., Jamnagar against overdraft limit sanctioned to the bank. The balance outstanding against the said facility as on 31.03.2015 was Rs. NIL. (Previous Year : Rs. NIL)

4. Contingent Liabilities :

(a) **Contingent Liability towards Guarantees issued by the bank on behalf of customers is Rs. 32,95,000/- (Previous Year : Rs. 32,95,000/-)**

(b) **As per section 26A of the Banking Regulation Act, 1949, the Reserve Bank of India has established the Depositor Education and Awareness Fund Scheme, 2014 (DEAF Scheme) through notification published in the Official Gazette on 24th May, 2014. As per the RBI directives, the bank is contingent liable for the amount lying with the DEAF Scheme. The details of the same is as under :**

	Current Year	*Previous Year
Opening balance of amounts transferred to DEAF	Nil	Not applicable
Add : Amounts transferred to DEAF during the year	1,17,41,682	Not applicable
Less : Amounts reimbursed by DEAF towards claims	3,77,672	Not applicable
Less : Claim receivable from DEAF	1,94,517	Not applicable
Closing balance of amounts transferred to DEAF	1,11,69,493	Not applicable

* Since the scheme has been notified in the Official Gazette on 24th May, 2014, the figures of previous year are not furnished.

(c) The income tax assessments of the Company have been completed up to Assessment Year 2012-13. There are no any disputed matters except for assessment year 2012-12 for which the Income-Tax Department raised demand of Rs. 17,66,790/-. Based on the decisions of the Appellate authorities and the interpretation of other relevant provisions, the Bank has been advised that no provision for tax is required.

Further, in view of appeal effect order of Appellate Order of ITAT, Rajkot in respect of A. Y. 2007-08 and A. Y. 2008-09 and consequential tax effect thereof for A. Y. 2009-10 and A. Y. 2010-11, shall create tax liability for that year, however, related re-assessment order/ rectification orders are yet to be passed hence, provision thereof is not made in the books.

The bank has not disclosed contingent liabilities as mentioned at Para No. 4(b) & 4(c) in the books of accounts.

5. Excess Provision not written back

The bank is appropriating every year, the amount towards distribution of gift to its members out of



profit by making provisions in the books of accounts. However, excess amount of provisions made were not written back in the books of accounts. Due to these, the provision of Gift to members as reflected in balance sheet under the head "Reserve Fund and Other Reserve" is overstated by Rs. 53,09,265/-. The year-wise details of the same are as under :

Financial Year	Provision made in the books of accounts	Actual expenditure	Excess Provision to be written back
2010-11	44,00,000	40,13,353	3,86,647
2011-12	41,75,000	40,73,762	1,01,238
2012-13	43,00,000	*Nil	43,00,000
2013-14	50,00,000	44,78,620	5,21,380
		Total...	53,09,265

6. Construction of Gulabnagar Branch :

The Bank has violated the Accounting Standard – 6 in respect of Fixed Assets, issued by the Institute of Chartered Accountants of India by showing the construction work in progress of Gulabnagar Branch Building amounting to Rs. 29,31,324/- under the head "Other Assets" instead of "Fixed Assets". Due to this, the amount of fixed assets is understated by Rs. 29,31,324/-.

1. Other Disclosures :

(a) Investments

(i) The Pattern of securities held under the Held to Maturity as on 31st March 2015 are as under:
(Rs. In Lacs)

Central Government Security (Face Value)	380.00
State Government Security	0.00
Total	380.00

Investments under "Held to Maturity" category are 0.86% as against maximum permissible limit of 25% of NDTL.

(ii) The pattern of other Securities held under the Held to Maturity as on 31st March 2015 are as under:
(Rs. In Lacs)

Other Approved Security	0.00
PSU Bonds	0.00
Shares of Co.-Operative Banks	0.05
Total	0.05

Total Investment in Held to Maturity of Rs. 380.05 lacs.

(iii) The pattern of other Securities held under the Available for Sale as on 31st March 2015 are as under:
(Rs. In Lacs)

Central Government Security	22388.03
State Government Security	4402.51
Mutual Funds	0.00
PSU Bonds	232.90
Other Approved Security	0.00
Total	27023.44



(b)Reserves:

(I) Investments Depreciation Reserve

	(Rs. In Lacs)
Investments Depreciation Reserve (As on 31.03.2014)	1281.36
Add: Provided from Profit & Loss Account of current year	0.00
Investments Depreciation Reserve (As on 31.03.2015)	1281.36

(ii) The Investments Fluctuation Reserve of Rs. 1079.67 lacs which worked out to 4.00 % of investments held under Available for Sales Category.

Sr. No.	Particulars	31-03-2015	31-03-2014
1	Capital to Risk Asset Ratio (CRAR)	28.01	26.14 %
2	Movement in CRAR		
	(i) Total Capital Funds	5312.65	4866.74
	(ii) Risk Weighted Assets	18969.65	18617.20
3	Investments :		
	(I) Book Value	27403.50	19712.90
	(ii) Face Value	28020.85	20120.85
	(iii) Market Value	28036.20	18352.70
4	Advances Against :		
	(i) Real Estate and Construction	1106.89	970.60
	(ii) Housing	4210.09	3975.32
5	Advances against Shares and Debentures	0.00	0.00
6	Advances to Directors and their relatives, companies /firms in which they are interested		
	(i) Fund Based	36.97	35.67
	(ii) Non Fund Based	0.00	0.00
7	Average Cost of Deposits	6.96%	6.61%
8	NPAs		
	(i) Gross NPAs	269.04	97.34
	(ii) Net NPAs	0.00	0.00
9	Movement in NPAs		
	(i) Gross NPAs		
	Opening Balance	97.34	130.25
	Add : Additions during the year	264.32	77.14
	Less : Reduction during the year	92.63	110.05
	Closing Balance	269.04	97.34
	(ii) Net NPAs		
	Opening Balance	0.00	0.00
	Add : Additions during the year	0.00	0.00
	Less : Reduction during the year	0.00	0.00
	Closing Balance	0.00	0.00
10	Profitability :		
	(i) Interest income as a percentage of working funds	8.23%	8.16%
	(ii) Non – Interest income as a percentage of working funds	0.32%	0.38%
	(iii) Operating profit as a percentage of working funds	2.17%	2.29%



	(iv) Return on average Assets	8.55%	9.06%
	(v) Business (Deposits + Advances) per Employee	503.52	450.84
	(vi) Operating Profit per Employee	9.83	9.11
11	Provisions made towards :		
	(I) NPAs	1911.47	1750.47
	(ii) Investment Depreciation Reserve – Investments	691.21	691.21
	(iii) Investment Depreciation Reserve – MNCB	590.15	590.15
	(iv) Standard Assets	449.50	404.50
12	Movement in Provisions :		
	(i) Towards NPAs		
	Opening Balance	1750.47	1625.62
	Add : Additions during the year	161.00	124.85
	Less : Reduction during the year	0.00	0.00
	Closing Balance	1911.47	1750.47
	(ii) Towards Depreciation on Investments		
	Opening Balance	1281.36	1081.36
	Add : Additions during the year	0.00	200.00
	Less : Reduction during the year	0.00	0.00
	Closing Balance	1281.36	1281.36
	(iii) Towards Standard Assets		
	Opening Balance	404.50	359.50
	Add : Additions during the year	45.00	45.00
	Less : Reduction during the year	0.00	0.00
	Closing Balance	449.50	404.50
13	Foreign Currency Assets and Liabilities	N.A.	N.A.
14	(i) Payment of DICGC Insurance Premium	44.08	38.90
	(ii) Arrears in Payment of DICGC Insurance Premium	0.00	0.00
15	Penalty imposed by RBI	0.00	0.00

(a) Details of Issuer composition of Non - SLR investments and non – performing Non – SLR Investment

(i) Issuer Composition of Non SLR Investments						(Rs. In Lacs)
No.	Issuer	Amount	Extent of 'below investment grade securities'	'Extent of 'unrated securities'	Extent of 'unlisted securities'	
(1)	(2)	(3)	(4)	(5)	(6)	
1	PSUs	232.90	NIL	NIL	NIL	
2	Fis	NIL	NIL	NIL	NIL	
3	Public Sector Banks	NIL	NIL	NIL	NIL	
4	Mutual Funds	NIL	NIL	NIL	NIL	
5	Others (Shares of Central & State Co.-Op. Banks)	0.05	NIL	NIL	0.05	



6 Provision held towards Depreciation NIL NIL NILNIL

(ii) Non Performing Non SLR Investment

Particulars	31-03-2015	31-03-2014
Opening Balance	NIL	NIL
Additions during the year	NIL	NIL
Reductions during the year	NIL	NIL
Closing Balance	NIL	NIL

		Housing Loan	SME Debt Restricting	Others
Standard Advances restructured	No. of Borrowers Amount Sacrifice (diminution in the fair value)	NIL	NIL	NIL
Sub Standard restructured Advances	No. of Borrowers Amount Sacrifice (diminution in the fair value)			
Doubtful Advances restructured	No. of Borrowers Amount Sacrifice (diminution in the fair value)			
Total	No. of Borrowers Amount Sacrifice (diminution in the fair value)			

For,
M/s Jaydeep Mehta & Associates (FRN : 122154W)
Chartered Accountants

Ramniklal K. Shah
Chairman

Dhirajlal J. Kanakhara
Vice Chairman

CA. Jaydeep D. Mehta (Mem. No. 102782)

Proprietor
Statutory Auditors

Place : Jamnagar

Date : 01st June, 2015

Kiranbhai R. Madhvani
Managing Director

Nileshbhai M. Tolia
Joint Managing Director

: Directors :

Dhirajlal M. Shah
Parmanand V. Khattar
Satishchandra M. Kundalia
Chandulal R. Shah
Nathalal V. Mungra

Subhashchandra K. Shah
Hiteshbhai G. Parmar
Hasmukhbhai I. Hindocha
Vijaykumar M. Sheth
Prashantbhai M. Mahrishi

A. R. Jhaveri
In charge General Manager

R. D. Adhiya
Assistant General Manager

**CASH FLOW STATEMENT FOR THE YEAR ENDED 31st MARCH 2015**

Particular	31st March 2015 Amount (In Rs.)	31st March 2014 Amount (In Rs.)
Operating Activity		
Net Profit as Per Books of Account	5,67,96,722	5,06,60,041
Add : Adjustment for Differed Tax Provision	1,40,000	-
Investment Depreciation Reserve	-	2,00,00,000
Provision for Share Holder	51,00,000	50,00,000
Provision for Rebate Payable to Puntual Borrower	40,00,000	29,00,000
Provision for Standard Assets	45,00,000	45,00,000
Product Linked Incentive	74,00,000	66,00,000
Provision for Expenses	2,71,972	8,67,015
Staff Bonus	13,625	12,689
Provision for Income Tax	3,55,00,000	1,85,00,000
Provision for Bad and Doubtful	85,00,000	48,00,000
Income Tax	7,52,459	38,69,170
Loss on Sale of Fixed Assets	18,245	82,493
Depreciation	77,42,093	70,83,846
Less : Adjustment For		
Share Transfer Fees	27,457	32,736
Dividend Income	750	750
Profit and Sale of Fixed Assets	1,09,593	1,42,650
Nominal Member Fees	3,400	23,025
Increase / (Decrease) in Working Capital and Other Reserves		
Increase / (Decrease) in Advances	3,72,21,225	21,74,41,129
Increase / (Decrease) in Other Assets	22,90,096	2,461
Increase / (Decrease) in Investments	71,56,13,948	10,60,91,966
Increase / (Decrease) in Deposits	61,59,53,895	37,12,56,790
Increase / (Decrease) in Overdue Interest Reserve	2,07,987	74,971
Increase / (Decrease) in Other Liabilities	2,00,006	13,650
Increase / (Decrease) in Interest Payable	-	87,643
Increase / (Decrease) in Bills Payable (Bharvapatra Bills)	1,43,59,913	73,97,132
Increase / (Decrease) in Bad Debts Written Off	-	8,52,756
Increase / (Decrease) in Income Tax Liability of Previous Years	80,428	25,63,193



Increase / (Decrease) in Reserve Fund and Other Reserves	69,08,442	65,86,909
Net Cash Inflow (Outflow) from Operating Activity Before Tax	2,95,18,247	15,48,53,295
Less : Current Year Advance Income Tax Paid	3,06,64,832	2,01,32,268
Net Cash Inflow (Outflow) from Operating Activity After Tax - (A)	6,01,83,079	13,47,21,027
Investing Activities		
Increase in Fixed Assets	64,60,826	80,92,879
Sales Proceeds from Fixed Assets	6,16,128	3,50,935
Dividend Income	750	750
Net Cash Inflow (Outflow) from Investing Activity - (B)	58,43,948	77,41,194
Financing Activities		
Share Transfer Fees	27,457	32,736
Nominal Member Fees	3,400	23,025
Increase in Share Capital	81,48,375	1,03,66,250
Gift Paid to Share Holder	44,78,620	-
Dividend Paid	1,02,87,019	96,89,895
Net Cash Inflow (Outflow) from Financing Activity - ('C)	65,86,407	7,32,116
Cash and Cash Equivalents at the beginning of the period	40,01,73,558	27,24,61,609
Change in Cash and Cash Equivalents (A + B + C)	7,26,13,434	12,77,11,949
Cash and Cash equivalents at the end of the period as per statement of financial position	32,75,60,124	40,01,73,558

The Above Cash Flow Statement has been prepared under 'Indirect Method' as set out in the Accounting Standard - 3 on Cash Flow Statement

For,

M/s Jaydeep Mehta & Associates (FRN : 122154W)
Chartered Accountants

CA. Jaydeep D. Mehta (Mem. No. 102782)
Proprietor

Statutory Auditors

Place : Jamnagar

Date : 01st June, 2015

Ramniklal K. Shah
Chairman

Dhirajlal J. Kanakhara
Vice Chairman

Kiranbhai R. Madhvani
Managing Director

Nileshbhai M. Tolia
Joint Managing Director

: Directors :

Dhirajlal M. Shah
Parmanand V. Khattar
Satishchandra M. Kundalia
Chandulal R. Shah
Nathalal V. Mungra

Subhashchandra K. Shah
Hiteshbhai G. Parmar
Hasmukhbhai I. Hindocha
Vijaykumar M. Sheth
Prashantbhai M. Mahrishi

A. R. Jhaveri
In charge General Manager

R. D. Adhiya
Assistant General Manager



પરિશિષ્ટ - ૧

રોકાણોની વિગતો તા. ૩૧/૦૩/૨૦૧૫

નોન એસ.એલ.આર. રોકાણો

મુદતી થાપણો	રકમ	રૂ.
૧. માઘવપુરા મર્કન્ટાઈલ કો-ઓપરેટીવ બેંક લી.	૫,૯૦,૧૪,૯૯૭.૦૦	
૨. સેન્ટ્રલ બેંક ઓફ ઈન્ડીયા	૬,૩૨,૩૪,૧૬૪.૦૦	
૩. બેંક ઓફ બરોડા	૭,૫૨,૧૬,૦૬૦.૦૦	
૪. આઈ.ડી.બી.આઈ. બેંક	૫,૭૦,૦૦,૦૦૦.૦૦	
૫. યુનીયન બેંક ઓફ ઈન્ડીયા	૧૭,૦૨,૯૩,૧૧૩.૦૦	
૬. કેનેરા બેંક	૬,૨૦,૦૦,૦૦૦.૦૦	
૭. ઈન્ડિયન ઓવરસીઝ બેંક	૨,૦૦,૦૦,૦૦૦.૦૦	
	૫૦,૬૭,૫૮,૩૩૪.૦૦	
જાહેર સાહસો ના બોન્ડ્સ		
૮. પાવર ફાઈનાન્સ કોર્પોરેશન બોન્ડ્સ	૨,૩૨,૯૦,૦૦૦.૦૦	
	૨,૩૨,૯૦,૦૦૦.૦૦	
અન્ય રોકાણો		
૯. પોસ્ટ ઓફિસ	૭૪૭.૫૦	
૧૦. જામનગર ડિસ્ટ્રીક્ટ કો.ઓપ. બેંક લી.	૫૦.૦૦	
૧૧. ગુજરાત સ્ટેટ કો.ઓપ.બેંક લી.	૫,૦૦૦.૦૦	
	૫,૭૯૭.૫૦	
કુલ નોન એસ.એલ.આર. રોકાણો (અ)	૫૩,૦૦,૫૪,૧૩૧.૫૦	

એસ.એલ.આર. રોકાણો

સ્ટેટ ડેવલપમેન્ટ લોન સીક્યોરીટીઝ		
૧. આંધ્રપ્રદેશ સ્ટેટ ડેવલપમેન્ટ લોન	૧૩,૯૧,૭૭,૪૬૪.૦૦	
૨. મહારાષ્ટ્ર સ્ટેટ ડેવલપમેન્ટ લોન	૧૬,૪૭,૮૦,૦૦૦.૦૦	
૩. ગુજરાત સ્ટેટ ડેવલપમેન્ટ લોન	૧૦,૦૦,૮૫,૦૦૦.૦૦	
૪. તામીલનાડુ સ્ટેટ ડેવલપમેન્ટ લોન	૩,૬૨,૦૮,૮૦૦.૦૦	
	૪૪,૦૨,૫૧,૨૬૪.૦૦	
ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીયા સિક્યોરીટીઝ		
૫. ગવર્નમેન્ટ ઓફ ઈન્ડીયા લોન	૨,૨૭,૬૮,૦૩,૨૦૧.૦૦	
	૨,૨૭,૬૮,૦૩,૨૦૧.૦૦	
મુદતી થાપણો		
૬. ગુજરાત સ્ટેટ કો.ઓપ. બેંક લી. અમદાવાદ	૪,૦૦,૦૦૦.૦૦	
	૪,૦૦,૦૦૦.૦૦	
કુલ એસ.એલ.આર. રોકાણો (બ)	૨,૭૧,૭૪,૫૪,૪૬૫.૦૦	
કુલ રોકાણો (અ) + (બ)	૩,૨૪,૭૫,૦૮,૫૯૬.૫૦	